

# આધ્યાત્મિક કેડી

તંત્રી : સંપાદક : કૈલાસબહેન એન. પરીઅ



॥ પરમ તેજદાત્રી મા ગાયત્રી ॥

ॐ ભૂસુદ્ધિ: સ્વઃ ॐ તત્ત્વાવિતુર્વેણ્યઃ ભગો દ્વાર્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત् । ॐ ॥

# શ્રી ગાયત્રી ઇન્ડિશન ટ્રસ્ટ

## અમદાવાદ - ૧૬

[ ૨૪. નં. ૩૩૧ ]

ગાયત્રી ઉપાસક પૂજય શ્રી શાલ્વીજીએ (નરેન્દ્રભાઈ ખી. દુવે) માર્ચ ૧૯૭૫થી આ ગાયત્રીના આદેશથી લોકસેવાનો અભિગમ સ્વીકાર્યો છે. આધિ-બ્યાધિ-ઉપાધિથી ત્રસ્ત વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપી તેમના પ્રશ્નો સુલગ્નવાનાનો પ્રયત્ન તેઓ વિના મૂલ્યે કરી રહ્યા છે. અસાધ્ય બિમારીથી વ્યથિત વ્યક્તિઓને પૂજયશ્રી મા ગાયત્રીના આદેશ અને આર્ગફર્શન અનુસાર શક્તિપ્રદાનની સારવાર આપી રોગમુક્ત કરવાનો પ્રયાસ કરે છે. અભિમંત્રિત જીવનજળ માનવાતું જીવન બનાવે છે અને જીવન બચાવે છે.

ભારતમાં અને વિદેશોમાં પૂજયશ્રીની સેવાનો લાભ વિશ્વાળ જનસમૃદ્ધાયે લીધો છે અને લઈ રહ્યા છે. યાંત્રયુગમાં જીવત્તા માનવને આધ્યાત્મિક શરણુનો સીધો, સરળ રાહ બતાવી માનસિક શાંતિનો અનુભવ કરાવે છે.

પૂજયશ્રીના આ અનોખા અને વિરલ કાર્યયરનો લાભ કોઈ પણ રાતિ, જાતિ, ધર્મ કે સમપ્રદાયના વિશ્વાળ જનસમૃદ્ધાયને મળી શકે તેવા શુભ આશ્રયથી પૂજયશ્રીની પ્રેરણું અને મા ગાયત્રીની ઇપાથી શ્રી ગાયત્રી ઇન્ડિશન ટ્રસ્ટની સ્થાપના કરવાનો એક નાન પ્રયાસ કર્યો છે.

આ ટ્રસ્ટના મુખ્ય હેતુએ નીચે પ્રમાણે છે :

- (૧) ગરીબ તથા જરૂરવાળા માણુસોને દરેક પ્રકારે મહુદ કરવી.
- (૨) કોઈ પણ પ્રકારના શિક્ષણના ક્ષેત્રમાં મહુદ કરવી.
- (૩) આધ્યાત્મિક સારવાર-કેન્દ્ર રથાપી અસાધ્ય બિમારીમાંથી લોકોને રાસ્ત અપાવવી.
- (૪) કુદરતી આકાશમાં સપ્તાયેલાઓને સહાયરૂપ થવું.
- (૫) વિશ્વબંધુત્વની ભાવના કેળવી માનવજલને દરેક વિષમ પરિસ્થિતિમાં સહાયરૂપ થવું.

અમારા આ નાન પ્રયાસને આપ વખાવી કેશો અને વેગવંતો બનાવશો તેવા નાન વિનંતી.

આભાર સદ.

સરનામું :

કે. એન. પરીખ

મેદનનો બંગલો, સીવીલ હોસ્પિટલ ફર્પાઉન્ડ,  
અસારવા, અમદાવાદ-૧૬. (ગુજરાત) (ઇન્ડિયા)

ફોન : ૬૭૬૬૭

કે. એન. પરીખ

મેનેજરિંગ ટ્રસ્ટી

શ્રી ગાયત્રી ઇન્ડિશન ટ્રસ્ટ



આ તૈમાસિક અંક  
નન્યાયારી,  
અપ્રિલ,  
જુલાઈ  
અને  
ઓક્ટોબર  
માસમાં  
પ્રગટ થશે.

વાર્ષિક લવાજમ  
દિપિયા દરા

પ્રકાશક :  
શ્રી હેલાસથન એન. પરીખ  
શ્રી ગાયત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ,  
મેટ્રન ક્વાર્ટર્સ, ન્યૂ સીનીલ હોસ્પિટલ ફર્માઇન્ડ,  
અચ્છાદા.  
અમદાવાદ - ૩૮૦૦૧૬

મુદ્રા :  
કાન્દિકાઈ અ. ભિલી,  
આદિત્ય મુદ્રણાલય,  
રાયઘાર,  
અમદાવાદ - ૩૮૦૦૦૧

# આદિત્યાદિત્માક કેડી

વર્ષ ૫ ] • જુલાઈ : ૧૯૮૬ • [ અંકૃત લે

## અનુક્રમણીકા

૧. ધર્મસિદ્ધિનું સાધન ... ... ... ... ... ...	૩
૨. ડિરામતની અણાત દિતાય ... ... ... ...	૫
૩. આતા કદી કુમાતા થતી નથી ... ... ...	૬
૪. પૂ. શુદ્ધેવના સાનિધ્યની પગોભા... ...	૧૨
૫. આત્મગુંજન-૬ ડૉ. કાન્દિકાઈ કાલાણી ૧૬	
૬. ભક્તિ એ જ સર્વશ્રોષ ભાગ છે ... ...	૧૮
૭. શાનગોઠિ ... ... ... ... ... ...	૨૦
૮. કરમાયેલું કૂલ પ્રકૃતિસત અન્ય ! ...	૨૪
૯. પૂ. શુદ્ધેવનો અમેરિકાનો કાર્યધરા ...	૨૭
૧૦. સમાચાર ... ... ... ... ... ...	૨૮





આધ્યાત્મિક કેળી

જુલાઈ : ૧૯૮૬



## ધર્મસિદ્ધિનું સાધન

ધર્મનું સાધન છે. એટલે કે ધર્મ સિદ્ધ કરવા માટે શરીર જરૂરી છે.

ધર્મને વ્યાપક અર્થમાં લેવાનો છે. ધર્મ એ હૃવળ જ્ય, તપ, દાન, પૂજા, સેવા, દૈવદર્શનના આચરણમાં જ સમાઈ જતો નથી. પુછ ધારયતિ ધતિ ધર્મ.

ધર્મ એટલે ફરજ. મનુષ્ય અવતારમાં ભાનવીની અનેક ફરજો છે. પ્રથમ ફરજ તે મનુષ્ય અવતારને અજવાળવાની. મનુષ્ય અવતારને અજવાળવા તેણે સમગ્ર જીવનનો સુપેરે ધાર ધડકે છે. આ ધાર તે સુક્ષમ ધાર. ડેવળ અણ્યા, ડીઓ લીધી, નોકરી કરી, પરણ્યા, સંસાર માંડ્યો વગેરે કંઈ જીવનનો ધાર નથી. છે પણ રથૂળ. એ રથૂળમાં સુક્ષમતાને સિદ્ધ કરવા શરીરનો ઉપયોગ કરવાનો છે.

જેમ સાધન નક્કર અને મજબૂત હોય તેમ તે અનેક જાતનો ભાર વેંદારી શકે છે તેમ શરીર નો મજબૂત હોય તો તે અનેક જાતના સહભોં કરી શકેશે.

મનુષ્ય પાસે સમાજ અને કુદુંબની અનેક પ્રકારની જવાખદારીઓ છે. એ અદ્દ કરવાની પવિત્ર ફરજ છે. એ માટે દદ આત્મઅળનો આવિલાલ શરીરને નક્કર અને મજબૂત બનાવે છે. જીવનમાં કોઈ ત્રણ નાના-મોટા કાર્યો હું સિદ્ધ કરી શકીશ એવો લાવ આત્મભાભી બળ જગાડે છે ને વધારે છે.

આ લૌટિક કાર્યો સિદ્ધ કરવાનો તરીકો થયો.

આધ્યાત્મિકતાની વાત કરીએ તો શરીર લોખંડ જેવું નક્કર અને મજબૂત બને તે આવશ્યક છે. પ્રાચીનકાળમાં અને આજે પુણ્ય અનેક પુરુષો જંગલમાં જર્દ તાપ, ટાઢ, વરસાદ તેમ જ અન્ય મુર્કેલીઓ વળીને સાધના-તપશ્ચર્યા ફર છે. એટલું જ નહિ, ઉપાસના વધેર્પર્યાન્ત આલુ રહે છે. એમાં દીલા-પોચાનું કાબ નહીં.

એક જ સાદી વાત કહીએ કે જ્યારે પૂજા કે જ્ય કરવા ઐસીએ છીએ ત્યારે ટ્યાર ઐસવાનું છે. પ્રાતઃકાળમાં જાડી જ્ય કરવાનો, ઉપાસન, કરવાનો અનેક સંતો આદેશ આપે છે ત્યારે આપણા શરીરની અનજતતા, નક્કરતા, ને મજબૂતાઈ હોય તો જ અનુધાન વેળા કલાકો સુધી કે વેનિક ઉપાસનામાં થોડાએ સમગ્ર પણ આપણે ટ્યાર ઐસી શકીશું. અન્યથા કર્મર અને પગ દુખવાની ઇરિયાદ અણાની હોય છે. શરીર તંહુરરત હોય ને દદ આત્મઅળ હોય તો આપણે અવશ્ય પ્રાતઃકાળે નિદ્રા તાગ કરી જ્યાન, જ્ય, પૂજા, ઉપાસનામાં ઐસી શકીશું. કોઈ પણ પ્રકારની શારીરિક સ્વસ્થતા

આધ્યાત્મિક કેળી, જુલાઈ, '૮૬ ]

૩

ઉપાસના માત્રના આનંદને અવરોધી શકે છે. સામાન્ય માયું દુઃખતુ હોય કે શરીરીથી માયું ભારે થયું હોય તો ય જ્યે ને ધ્યાનના રૂપનો અવરોધાય છે.

જ્યે અને ધ્યાનના રૂપનોને, ઉપાસનાની વિરલ ને અલૌકિક શક્તિને જીવના ભારે શરીર નિરોગી હોયું ને રહેવું આવશ્યક છે ત્યારે ઉપાસનાકીય ઉપાયો અજમાવવાની તેથી જ તો જરૂર પડે છે. મોગથી શરીર ને મન ક્ષીણું બની જશે તો આપણે આપણું ચિત્ત પરમાત્મામાં પરોતી ન શકીશું. તેથી જ ઈશ્વરમાં લીન જનવા ને રહેવા ભારે તેમ જ રોગને નિર્મળ કરવા આપણે જ્યે, ધ્યાન ઉપાસનાનો આશ્રય લઈએ છીએ.

માનવીના જીવમનું અંતિમ ધ્યેય, મુખ્ય ફરજ-ધર્મ પરમાત્માને ઉપાસવાનો તેમ જ માર્ગ કરવાનો છે, તેથી જ શરીરના જ્ઞાનની ભાવજ્ઞત કરવાની છે.

માનવીય શરીર પરમાત્માનું વિરલ ને બ્રાંથ સર્જન છે. એ અને પુરુષના મનુષ્ય શરીરમાં જગવાને ચોક્કસ પ્રકારની રચના કરી છે. એ ઊંઘી-પુરુષના શરીરનો ચોક્કસ વિનિયોગ છે. શરીરની આત્મ ડિયાએ આપોઆપ અવિરત ચાલતી જ રહે છે. એ કન્દી રીતે ચાલે છે? એને ચાલતનાર ડાણ છે? એ પ્રક્રિયામાં સહેજ પણ વિકાર કે અવરોધ જીવો થાય ત્યારે વિશ્વાનનો આશ્રય લેવાય છે પણ એ વિશ્વાનનું સર્જન પણ ઈશ્વરીય જુહ્બિને જ આધીન છે. તેથી શરીરના તે વિકાર કે અવરોધના સંભાર્જન ભારે પરમ તત્ત્વની શક્તિનો જ આશ્રય પ્રથમથી જ લેવો જોઈએ તેમ જાને છે.

આત્મા એ જ પરમાત્માની ઉક્તિ સુવિહિત છે. આં આત્મા મનુષ્યના શરીરમાં આવેલો છે. આ આત્મામાં જ પરમાત્મા બિરાળેલા છે. તેનાં આપણે દર્શન કરવાનાં છે. પ્રાપ્તિ કરવાની છે. જ રીતે આપણે પૂજના સ્થાનને, મંહિરને સ્વર્ણ, સુખડ, પવિત્ર રાખીએ છીએ, પરમાત્મા-જગવાન કે પોતાના ધૃષ્ટ બિરાજમાન છે તેથી જાવવાથી આપણે જતજતના પાથરણી, વસ્ત્રો તેમ જ જીવન જ્ઞાન-ગારથી તે જગ્યા વગેરેને સુશોભિત કરીએ છીએ; તે જ રીતે પ્રભુના સ્થાન આત્માને, આત્મા જોમા રહેલો છે તે શરીરને, સદગુરુઓ, સદાચરણો અને શક્તિથી સંપત્તિનાવવાનું છે. પરમાત્માની હિંય અને અલૌકિક શક્તિનો અનુભવ કરવા, તેની પ્રાપ્તિ કરવા, તે જીવન ભારેતું સાધન પણ હિંય, અલૌકિક જુણો અને શક્તિથી સંપત્ત રહેલું ને હોયું જોઈએ તેમ જાગે છે.

અઠી કુલ શરીરની જ ભાવજ્ઞત કરવાની વાત નથી. ઉક્તિનારે શરીરને જ્ઞાન જ્ઞાનયું છે. એ જ્ઞાનને-શરીરને કર્ફ રીતે સંભાર્જિત ને સુશોભિત કરવું જોઈએ તે અંગે વિચારો. બ્યક્તા કરવાનો ઉપકુમ છે.

શરીરને આપણે જ્યારે ધર્મનું સાધન કરીએ હે ગણીએ છીએ ત્યારે એ સાધનની-શરીરની-શરીર દ્વારા થતી બધી જ ડિયાએ-કૃતિએ. પવિત્ર ને સાત્ત્વિક બની રહે એ જરૂરી જાગે છે.

શરીર વ્યક્તનોનું જોગ બને છે. ન કરવાના કેટલાક આસુરી-અસાત્ત્વિક ને અપવિચ રહેવાતો કાયોભાં શરીર રોકાયેલું રહે છે જેને કારણે શરીર દૂષિત થાય છે. એમાં રોગોનો જન્મ થાય છે. જેમ જીધું વસ્તુઓને હારી આય એ તેમ અસાત્ત્વિક આચારસરણીથી શરીરમાં પેઢલી રોગની ઉધ્ઘર્ષ જાઓ શરીરને હારી આય છે.

શરીરને જેટલું પવિત્ર અને સાત્ત્વિક રાખીશું તેટલું મન પવિત્ર ને સાત્ત્વિક બનશે. એ મનમાં ઉદ્ધૂભવતા વિચારો. પણ પવિત્ર ને સાત્ત્વિક બનશે.

આધ્યાત્મિકતાના જોડાણ અને તેની પરિપૂર્ણતા માટે હેસાચા માનવી બનવા માટે પણ તને ને અન એક ઘડ-એક મૂળ-એક પાયાનું કામ કરે છે. પાયો જેઠલો નજીર તેટલી તેના પર રચાતી ઈભારત અજ્ઞાત બને. એટલે મૂળમાં જ જીંદગિની ફરવાની જરૂર રહે જે બહુ સ્વાભાવિક લાગે છે.

બાધી શરીર નાથવંત છે તેમ છતાં પ્રલુબે માનવશરીર ધડખું છે. જુદ્દા જુદ્દાં પ્રાણીઓ, જીવને પણ શરીરના ચોક્કસ આકારો આપ્યા છે તેનો કંઈક તો હેતુ હશે જ, એ તદ્દન નિરર્થક નહિ હોય. આપણે પરમાત્માના એ શરીર-ધડતરના હેતુને સમજવાનો પ્રયત્ન કરીએ.

કેટલાક જણુને આપણે કહેતા સાંભળાએ છીએ હે પડપણુંમાં જોવિંદ્યુષ ગાયું. ત્યારે શું વૃદ્ધત્વ-પડપણુનો કાળ જ જોવિંદ્યુષ ગાવા માટે છે? યુવાનીમાં શા માટે નહિ? અથવા ઈશ્વરના અરિતત્વની સમજ આવી ત્યારથી શા માટે નહિ? કેટલાક યુવાનીમાં જ ઈશ્વરાભિમુખ બને છે તે તે ઉચ્ચિત છે, પણ જેની હાસી ઉડાવાય છે. એ બરાબર નથી લાગતું. યુવાનીમાં જોમ, સૂર્તિ, તાજગી ને શક્તિનો ધોાખ વહેતો હોય ત્યારે જ પરમતરત્વની શક્તિના મહાધોખ સાથે સુપેરે તાલ મેળવી શકાય છે. યૌવનનો મુનથનાટ હિંયતા, અંયતા ને અલોકિકૃતા સાથે થનગનાટ કરી શકે છે.

પ્રાતઃકાળમાં જિઠી ટદાર બેસી પોતાના ધજુની ઉપાસના કરતા, મંત્રજ્યં કરતા યુવાનમાં સુષુપ્ત શક્તિનો સંચાર થવા માટે છે. શક્તિનો આ સંચાર યૌવનની મોહકતા પ્રેર છે. આવે યુવાન તેના શક્તિના ઉત્તરાધ્યકાળમાં શરીર કૃષ કે ક્ષીણ થવા છતાં તેનું અન શક્તિ, આત્મધાર કે આત્મવિશ્વાસ મુાખ્યત્વં નથી. એ જ આત્મધારને આત્મવિશ્વાસ વડે કૃષ કાયા હોવા છતાં પ્રલુબજ્ઞનમાં લીન અની શકે છે. આદી શરીર જ્યારે ક્ષીણ થવા માટે છે ત્યારે મનોશક્તિનો ધોાખ પણ ઓસરવા માટે છે. એ કો હે ન થનું જોઈએ, છતાં થાય છે. ત્યારે આપણે ટદાર બેસી પૂજા, જરૂર કરી શકતાં નથી. અહેખર જ્યારે જોવિંદ્યુષ ગાવાનો સમય આવે છે ત્યારે જોવિંદ્યુષ ગાઈ ચંડાતાં નથી. અહેખર જ્યારે જોવિંદ્યુષ ગાવાનો વખત હતો લારે આપણે પડપણુંમાં ગાવાનો વિચાર હર્યે. આમ ન તો આપણે યુવાનીમાં કે ન તો વૃદ્ધત્વમાં જોવિંદ્યુષ ગાયા ને એમ ને એમ મનુષ્ય અવતાર મૂરો જીવાની બેળા આવી પહોંચી. પ્રલુબે આપેલ શરીરનો. આપણે હોઈપણ સત્કર્મમાં ઉપયોગ ન કર્યો. આપણા જ શરીરના આત્મામા બેઠેલ પરમાત્માને ઓળખવાનો હે પાભવાનો પ્રયત્ન સુદ્ધા કર્યો નહિ. 'અભ્યા લારથી જ સાવાર'ની ઉક્તિ સુજ્યં જ્યારથી ઈશ્વરની જાણ થઈ ત્યારથી જ જે તેની ઉપાસના આદી હશે તો અતિમાને મલ્લતા નાન સાથે જ આ શરીર પડી જશે ને તે પરમધારમાં ખરોંચરો. એ જ મનુષ્ય અવતારની સાર્થકતા ગણ્યાય. એટલું જ નહિ, આપણા સમય મનુષ્ય-અવતાર દરમ્યાન આપણા જીવન અને સંસારની પવિત્ર ઇરણે પ્રેમપૂર્વક અદા હરી હશે, ને સંપૂર્ણ શક્તિ અને દરખાતિપૂર્વક ધજુની ઉપાસના આદી હશે લારે જ મનુષ્ય-અવતારની સાર્થકતા અનુભવારો. શરીર એ ધર્મનું સાધન છે. જીવન દારા ધર્મ, ઇરણે અદા ફરવાની આપણી પવિત્ર ઇરજ બની રહે છે.

□

## કિરમતની અજ્ઞાત કિતાબ

મ

રા ભાગમાં શું લખ્યું છે ? મારા દાખતની

રેખાઓ મારું શું ભાવિ સૂચયે છે ? મારી જન્મકુંડળામાથી અવિષ્ય જાણવાની ધર્છા છે. કિરમત બાખાયેલી કિતાબ લઈને જન્મેલ માણુસને કિતાબ વાચતાં આવડતી નથી. એનું એક એવું પાતું એની જલે જ ઉપરે છે અને અનુભવાતું જાય છે. પરંતુ આપણી જિજીવિષા એક જ દિવસમાં આપી કિતાબ વાંચી લેવાની-લાણી લેવાની છે અને આ કિરમતની કિતાબ વાંચવામાં નિષ્ણાતની તલાશમાં આપણે હમેશા રહેતો હોઈએ છીએ.

અરદ્ધોદોષ, પામીરદી, તલશાઅ, ફેઝસ-રીડીંગ વગેરે કિરમતની કિતાબ વાચવાના શાંખો છે. તેમાં પારંગત થનાર તે વાંચી પણ શકે. પરંતુ વાંચીને-લાણીને પછી શું ? દુઃખી ભાવિ જાણીને આજથી જ અશાંતિ જીબી કરવાની કે બીજું કોઈ ? એક માણુસને એના કિરમતમાં અડવાડિયા પછી મરી જવાતું લખાયું હોય અને તે મરવાની વાત આજે જ લાણે તો આપું અડવાડિયું તે મૃત-અવરથામાં જ કાઢે. મરવાના નિશ્ચિત હ્વિસે તો તે મરવાનો જ છે પરંતુ આજથી જ તે મરવાની રહેલાં દુઃખી થઈ ને જુયે છે.

પરમાત્માએ આપણું આપણની જાણકારી શા માટે જન્મની સાથે સાથે જ ન આપી ? આપી હોત તો આપણે ફેરફારી સુખી હોત તેવી ફેરફારની ફ્લીલ છે. પૂજ્ય ગુરુહેલ પાસે પણ આઈ-બહેનો જન્મ-માસ્કર લઈને આવે છે. અવિષ્ય જાણવાની ઈતેજારી બતાવે છે. પૂજ્યશ્રીનો જવાબ હોય છે, ‘આઈ, કિરમતનું પાતું દરરોજ જીવારે ખૂલે છે, તેના લખાણ પ્રમાણે જીવનમાં જે તે સમયે જનાવ થનતા જ રહે છે. અવિષ્યનું સુખ કે દુઃખ અગાઉથી જાણી લઈએ તો જે તે સમયે તેનો આસ્વાદ માણી જાડાય નહિ. પરમાત્માની-મા ગાયત્રીની શરણાગતિ સ્વીકારી, નૈતિક જીવન જીવીએ. માતાજી ગ્રહે પણ બદલી શકે છે. દુઃખ અને સુખ જરૂરવાની શક્તિ આપણું અળતી રહે છે. “શુણો ધા સોયથી જર્ખા” જેવું મહેસૂસ થાય છે. દુઃખના સમયે અડવિપત દૈવી સહારો, સહાય મળો જાય છે. નિરંતર ગાયત્રી મંત્ર જપ અને નૈતિક જીવનધોરણ આપણું કષ્ટયની જેમ રક્ષણ કરે છે.

કિરમત શું છે ? આપણું ગત જન્મના સંચિત કર્મનો વારસો, કર્મથી શુંખા સાથે જ આપણો જન્મ થાય છે. સહકર્મોથી આપણે જીવનને અજીવાળી શકીએ અને પરમાત્માનું સાનિષ્ય પામી સુખ, શાંતિ, સંતોષનો અનુભવ કરી શકીએ, અને આવી પડતા દુઃખને જરૂરવાની શક્તિ જોગી શકીએ છીએ.

સુધીના સર્જનહાર ખલાજુએ માનવને તેના કિરમત સાથે પૃથ્વી પર અવતરણ આપવા છતો કિરમતના ગાનથી શા માટે વંચિત રાખ્યો તેની એક રૂપક હ્યા નીચે પ્રમાણે છે :

વિધિના લેખ પર મેખ મારી ધરતી પર સે વર્ષનું દુઃખભયું આયુષ્ય વિતાવવાને બહલે અનુષ્ય-સોફમાં અવતરવાની લાઈનમાં ઉભેલા અગિયારમા માણુસે દુઃખની હારતાન ખલાજુના સુખે સાંખળી હેવલોફમાં જ ગ્રાણ છોડ્યા અને વિધિના લેખ ખોટા પાડ્યા. ત્યારથી જ માજ સુધી જન્મ અગાઉ અનુષ્યને તેનું ભાગ્ય વાંચી સંબળાવવામાં આવતું નથી. પરંતુ અનુષ્ય તેનું ભાગ્ય જાણવાની જરૂરાંહ હતિને સંતોષી શકતો નથી. તેથી મણોનો, જાણારોનો, સંતોનો સહારો લઈને તેની જિજાઓ સંતોષવા પ્રયત્ન કરે છે.

‘આધ્યાત્મિક કેડી, મુલાદી’ ૧૧

આની એક સુંદર મોખકથા તુર્ગનેવે લખી છે :

‘વિધાતાએ સૃષ્ટિના સર્જનકાર્ય વેળાએ પહેલાં પ્રાણીસૃષ્ટિ, રથગચ્છર, જળગચ્છર, નભગચ્છર વગેરે પ્રાણીઓ ઉત્પન્ન કર્યાં, પછી વારો આવ્યો મનુષ્યનો.

મનુષ્યમાં બુદ્ધિતર્ય હોઈ હરેક મનુષ્ય તેનું જીવન સારી રીતે સમજ-વિચારીને વ્યતિત કરી શકે જે હેતુ લક્ષ્યમાં રાખીને સૃષ્ટિ પર મોફલતા પહેલાં તેના હિસ્થતની આધી ઇપરેખા કરી સંભળાવવામાં આવતી. અલાજુને માનવસર્જનમાં એટલો અધ્યો આનંદ આવતો હતો. કે માનવને સૃષ્ટિ પર મોફલતા પહેલાં હેવસભાની વચ્ચે માનવને હાજર રાખવામાં આવતો અને બધા દેવોની હાજરીમાં તેને તેનું ભાગ્ય હેવવામાં આવતું. આજે એવા એક મનુષ્યયોનીમાં જન્મનાર વ્યક્તિત્વનું ભાગ્ય વંચાવાનું હતું.

‘હેવોનો’ દરખાર ભરેલો હતો. સિંહાસન પર અલાજુ વિરાજ્યા હતા. આરે તરફ શાંતિ પ્રસરી રહી હતી. અલાજુએ ધીરગંભીર વાણીમાં હેવદૂતને આદેશ કર્યો, “જીવ અગિયારમે મનુષ્ય ને યોગી ક્ષણે આદ પૃથ્વી પર જીવન ધારણ કરવાનો છે તેને અધી સભા સમક્ષ હાજર કરો.”

અલાજુનો આદેશ થતાં જ હેવદૂતે તેને સભા સમક્ષ હાજર કર્યો. અલાજુનો આદેશ થતાં એક દેના ઉમા થયા. આખી સભામાં શાંતિ પ્રસરી રહી. અગિયારમે મનુષ્ય, ને ધરતી પર અવતરવાનો છે. તેનું ભાગ્ય સંભળવા તૈમાર થઈ જિબો રહ્યો. ભાગ્ય વાંચનાર હેવતાએ સુવર્ણ નલિકામાંથી તેનું ભાગ્યપત્ર કાઢ્યું અને અલાજુને વંન કરી શુલંદ અવાજે ભાગ્ય વાંચવાની શરૂઆત કરી :

“તમે ધરતી પર એક અત્યંત સંપન્ન પરિવારમાં જન્મ ધારણ કરશો.” સુખી પરિવારમાં જન્મ ... માનવનું મન ખુશ થઈ ગયું. દેવોના મુખારવિંદ પર હાસ્ય ખીલી જિડ્યું. “માતાપિતાનું પ્રથમ સંતાન હોવાથી તેઓનો સર્વ પ્યાર તમારા પર ઢોળાશે. તમે પાણી માંગશો ત્યા દૂધ મળશો. માતા-પિતાના અધિક લાડોડને કારણે તમે વિદ્વાક્ષમાસથી વિમુખ રહેશો. પરંતુ માતાપિતાની અણો સંપત્તિનો વારસે તમને મળશો. અને એ કારણે જ તમને ધરપત રહેવાની કે નહિ અણીએ તેથી જિંદગી સુખમાં જ જવાની છે, પછી ચોપડાં વાંચવાની શ્રી જરૂર છે. તમારી જંગનીના પંદર વર્ષ આમ આનંદ-પ્રમેદ, ખેલકુદમાં વીતાવી દેશો દુઃખ શી ચીજ છે તેનો. અણુસાર માત્ર પણ તમને નહિ આવે.

પણ સમય હોઈ નો એકસરખો જરો. નથી. સુખ પછી દુઃખ, દિવસ પછી રાત્રિની ધર્માળ ચાલુ રહેતી હોય છે તેમ તમારા જીવનના સોળમા વર્ષથી લોઢાને પાયે પનોતી એસે છે. સોળમા વર્ષના ગ્રાંઝથી જ દુર્ઘટનાની શરૂઆત થશે; મોટર અક્સમાતમાં તમારો એક પગ જરો, જીબ કચરાઈ જવાથી બોલવામાં અને જમવામાં તકલીફ પડશો.”

ધરી પહેલાં હસું હસું થઈ રહેલ માનવનું મુખ પર અને હેવસભામાં જંબીરતાનું વાતાવરણ છરાઈ ગયું. “તમારી જ મરતા અતરમા વર્ષે માતાપિતાનું સુખ અને છત્રછાયા તમે શુમાવશો. દુઃખના વાહણો એક ચામરા ધર્મસી આવશો. દરખાર, માલમિલાકત, રીચરચીલું અધ્ય જ આગમાં સ્વાદા થઈ જરો. ચેતાનાના પારથે જૂલનારા અને દોખાની જાલખામી રાચનારા તમે રરતે રજળતા જિખારી જનો જરો. ભાગ્ય એટલું અધ્ય અતિકૂળ હરો કે હોઈ જાગીસંખ્યી તમારી સામું પણ નહિ શુંચે. લોડા ભીખ સુધી નહિ આપે. દિવસોના દિવસો ભૂખ્યા તરસા રહેતું પડશો. થોડા વખત પછી તમારી આંખોની જોગિ જરી રહેશે. લોડા તમને દેસે બદાવશો. પાઈ પેસા માટે તમારે વલખા મારવા પડશો.”

બાટીની નાની જ મરમાં આટલા બધા દુઃખની સીતમ-છડીએ મારોથી કરી રીતે સહન થતો તે વિચારે તેની આખમાં અણુભિંદુએ ટપકવા લાગ્યા.

हेवे आगला वाच्यवानुं शहर क्षुः : “आ पछी तमारा शरीरमा रक्तपित थरो. शरीरमा कीडा अदृश्यदरो. हर्दयी आकुणव्याकुण थर्डने तमे रडरो, आथुं झूटरो. परंतु कोई तमारी सामे ज्ञेशी नहि. समाजसंबंधी मेरा अचडाई चाल्या जरो. कामडा, समडी, झूतरा वज्रेरे तमारा शरीरना कीडा आवा तमने हेरान करो.”

विधाताए दुःख आपनामा पांचुं वाणोने ज्ञेयुं ज न हुं. आवा असीम दुःखोनी इस्तान सांखणाने हेवानी आयो. पछु अशुद्धी लींगाई गर्द. ते अभागी अनुष्ठनो अहेरो फीझो पडी जयो हो. तेचे अविलित स्वरे क्षुः, ‘अगवन्, आखलुं अधुं दुःख !’

‘चूप रहो. वयमां जोखनानी चेष्टा न करशो. जे वाच्याय ते शातिथी सालगो.’ अहं जुमे करडाईयी तीभा आवाजे क्षुः.

भियारो भानव चूप थर्ड गयो. भडापराशे आणा राखेलो अशुद्धांख तूरी गयो. भोटेथी इस्कुं क्षेवाई अयु. ला तो आग्य वाच्यनार हेवताए आगला वांच्यां भाऊयुं.

दुःख पछी सुखनी तेजनी लकीर हेखाशे, ते आशाए भनने अज्ञूत करीने तेचे तेनु आगलनु आग्य सांखणवा भाऊयुं.

“भीज एक अक्सरातमा तमे तमारा खंने हाथ गुमावरो. तमारुं दुःख एटलुं अधुं असल थर्ड पडरो हे तमने ज्ञवन करता भृत्यु भीहुं लागरो. तमे ग्रेतनो ईतेज्जर करशो. परंतु तमारुं कमभाग्य तमने सहेलाईयी भरवा हे तेम नथी. भृत्यु भुख झेवीने चाल्युं जरो.”

‘प्रभु... प्रभु... आवी असला यातना क्या सुधी भोगवती पडरो ?’

‘पूरा सो वर्ष’, हेवताए क्षुः.

‘एक्सो वर्ष... ?’ सो वर्ष सुधीनी यातनानो विचार आवता ज तेनी रडीसही शक्ति ओसरी थर्ड. एक हर्दभरी चीस पाडी, आयो. खंध करीने जभीन पर इसडाई पडयो, निश्चेतन थर्ड गयो. हेवसभामा हाहाकार भयी रखो. आग्य वाच्यनार हेवताना हाथमा भाग्यपत्र एमने एम रवी अयु. अलाज्जे टेवाना वैष धन्वंतरि उपर सूख क्षिणी झेवी, ते भानवने तपासना जस्तायु. धीमे पञ्चे धन्वंतरिज्ज जिआ थया, भानवनी नाडी हाथमा लीधी अने जस्तायु शरीर निष्प्राण्य थर्ड अयु छे।

अलाज्ज अने आभी हेवसभा रस्त्य अनी थर्ड, गमगीनी छ्वाई थर्ड. हेवसभामा भानव भृत्यु पाय्यो. होय एवी आ पहेली ज धरना हती. आज सुधीना वधा भानवाए नतभस्तहे खेतारु आग्य आंखणा लीधुं हुं अने पृथ्वीदेवाक पर ज्ञवन शहर क्षुः हुं. आ भानवे ज आग्य सांखणाने तेनी चेतना गुमावी दीधी.

अलाज्ज रातापीणा थर्ड गया. ए अभागी अनुष्ठना निष्पेतन शरीर पर एक करडी नज्जर हरी जस्तायु, ‘हरावो अने अहिंसाथी ! अने सौ सांखणा लो अने याह राखजे हे आज्ञथी कोईपछु भानवने तेना जन्म अगाह तेनु आग्य वाची संखणाववामा नहि आवे. ते आज्ञथी तेने अग्रात राखवामा आवरो.’

ए हिवस्थी पृथ्वी पर जन्म धारण्य करतार भानव तेना छिसमतनी छिताख थर्डने जन्मे उ परंतु ए छिताखना अभास्थी ते अग्रात रहे छे.

— अलेनल



[ आध्यात्मिक कृषी, युवाई, ८६ ]

માતા કઢી

## કુમાતા, નથી થતી

દરેક માનવીને જીવનમાં સફળતા-સુખ-સમૃદ્ધિ

જોઈએ છે. તે સ્વાભાવિક છે, પણ પ્રાર્થના-કર્મની ગતિ કાઈ જુદી જ હોય છે. કર્મની ગતિ માનવીના મનોરથોની આડે આવે છે ત્યારે તે અવરોધિને દૂર કરવા માનવી સ્વાભાવિક જ પ્રયત્ન કરે છે. કર્મની ગતિથી વાજ આવી ગયેલો મનુષ્ય ભાવિ પર ભીંટ માડીને બેસે છે. પોતાના જ પ્રાર્થના ભીતરમાં ડોકિયું કરવા તલસે છે પણ એમ કાઈ પ્રાર્થન થોડું કોઈને પ્રગત થઈ જય છે? કર્મના બણે જીવનમાં ઉદ્દેશ્યતા અનેકાનેક પ્રશ્નો માનવીને મુંજું તે સ્વાભાવિક છે. પણ એમાંથી માર્ગ કાઢવાનો એક જ ઉપાય છે — શ્રદ્ધા, અરથાત, સંયમ, ધીરજ અને નિષ્ઠા. આ સ્વક્રમ ભાવેને કેળવવાથી માનવીના અડવા પ્રશ્નો જ સુલજાઈ જય છે. પણ આવું તો આગ્યે જ કોઈ મનુષ્યમાં જોવા મળે છે.

જીવનના પ્રશ્નો સુલજાવવા માટે માનવીઓ જ્યોતિષીઓ, તાત્ત્વિકો, સત્પુરુષોને શોધતા દરે છે. કોઈકની પાસેથી જાણે કે સિદ્ધિની-સફળતાની કોઈ શુદ્ધિયાવી જડી જરી એવા આશ્વયથી. દરેક જીવ દરેક વેળા જુદી જુદી વાત કરે. છે. જુદી જુદી રીતે માર્ગદર્શન આપે, એક સંતમાં વિશ્વાસ બેસે ન જેસે ત્યા તો વળી ખીજતું નામ ચાંકળા તેની પાસે હોડી જવાનું, વળી નીળ પાસે, વળી કોઈ કથાં રહે ને કોઈની કંઈ હી. એક તો જીવનમાં ગૂંઘવાયેલા જ હોઈએ, ત્યા વળી એ ર ગૂંઘવણો જિની આથ. સમય, કંપિ અને નાથુનો વ્યર્થ વ્યર્થ અને પાણી ત્યાંના લા. સરવાળે કશ્યુ પ્રાપ્ત થતું નથી. છેને કંઈ નહિ તો માનસિક શાંતિ પણ મળતી નથી. આ ચક ચાલવા જ કરે છે. એનો કદમ્બિ અંત આવતો નથી. મનની ગૂંઘવણો અને અશાંતિ વધતી જ રહે છે.

જીવનમાં સુખ અને સફળતા કંઈ રસ્તામાં નથી પડશો. જ્યોતિષીઓ-સંતપુરુષો ખાસે એવા કોઈ નજીર પદાર્થો નથી કે જેનાથી જીવનમાં બધું મળી જાય.

એટલું ચોક્કસપણે પાછ રાખીએ કે, જીવનમાં સાચો રાખ હેખાડનાર ભાગ્યે જ કોઈ મળે છે. જીવનની મુસીઅતોમાં ભાગ્યે જ કોઈ સહાય કરે છે. અને એથી યે વિશેષ એક વાર જે સન્તના કે શુદ્ધના જ્ઞાનિધ્યમાં જયા પણી તેમના આદેશને-સિદ્ધાતને-માર્ગદર્શનને અનુસરતું એ જ મહત્વની વાત છે. આપણા ધાર્યા મનોરથો પર પડે કે ન પડે, પણ એટલા જ ભાતર કેરેર બદલા કરવું એ એ હિંદિત નથી.

અને એમ કોઈ ર્યે માને કે વિવિધ સંતોનો સંબન્ધ ન કરવો. દરેક સન્તના દર્શાન કરવો, કાસ્તંબ કરવો, પણ અન્તતોભત્તા દરેક સન્ત પ્રશ્નને—પોતાના ખંડને-માતાજીને મેળવવાની જ વાત કરે છે. તો પણ એ જ માર્ગને કા માટે ન અપનાવવો. જ સન્તના-શુદ્ધના આદેશના અનુસરણમાં જ એવ કામાગેલું છે, તે હી ન કુશાખ.

અને, આવી જ રીતે અટવાયેલા-ગૂંઘવાયેલા એ માનવીની વાત રજૂ કરી છે, તે સૌને માટે પ્રેરણ નીવડણી એવી આશા છે.

એ મુરાબી લખી જણાવે છે :

આધ્યાત્મિક કેઢી, જુલાઈ, '૮૬ ]

"આગોસ વર્ષની ઉમર થઈ પરંતુ જીવનમાં હજુ રિયર્સા આવી નથી. ધંધા માટે જ્યાં જ્યાં હાથ નાખું ત્યાં નિષ્ઠળતા જ સાંપડે છે. આજ સુધીમાં લગભગ દસથી બાર નોકરી-ધંધા બહસ્થા. ડાયલ ક્રેનલ્યુએટ હોવા છત્તાં એકારીમાં જીવું છું. ધથા સન્તોમા-તાંનિકામાં ફેરો. કચાયથી સાચો રાફ, માર્ગદર્શન કે શાંતિ મહિયાં નથી. હંમેશ વિજયને અને મારે દસ ગાઉનું છેડું રહી જાય છે.

સાત વર્ષ પહેલાં હું ગુરુહેવને મળ્યો. હતો. તેઓશ્રીના માર્ગદર્શન અતુસાર આચરણ કરવાથી થોડી સહળતા મળી પણ પછી બીજા સન્તોના સમાગમમાં આવ્યો. દર વખતે મારા જીવનમો રાફ બહસ્થાતો રહ્યો. ધડીક એકમાં વિશ્વાસ બેસે, ધડીક અન્યમાં. અત્યાર સુધી આ જ ચકમાં અટવાતો રહ્યો છું. હમણાં જ ગુરુહેવના એ પુસ્તકો 'અગોચરના ઊંડાણુંમા' અને 'ઉપાસનાનો રાજમાર્ગ' મારા વાંચવામાં આવ્યાં. એ-ત્રણ પ્રસંગે વાંચ્યા અને ગુરુહેવની સાત વર્ષ પહેલાની મુલાકાત તાજ થઈ. તેથી મુલાકાત અને માર્ગદર્શન માટે હરી ગુરુહેવ પાસે ગયો. ગુરુહેવ અને ગાયત્રી મહામંત્રની પાંચ માળા કરવાનો આહેશ આપ્યો. અને કલ્યાં કે 'એટલું યાદ રાખજો કે જીવનમાં જમે તેટલો કપરો. કાળ આવે છત્તાં પણ,

(૧) પરમાત્માની શક્તિમાં અનન્ય શ્રદ્ધા રાખજો.

(૨) આત્મવિશ્વાસ કેળવતો રહેજો.

(૩) ધ્યેયનિષ્ઠામાંથી અલિત ન થવું.

(૪) અવિરત પુરુષાર્થ કરવો.

(૫) પ્રેમ અને લગનથી ફરજ અનુવની.

(૬) સહ-કાર્ય કરત્યો સાથે સંમલાવ કેળવવો.

(૭) અન્યને ઉપરોગી થવા તત્ત્વર રહેવું.'

ભાલે હું ગુરુહેવને સાત વર્ષ પછી મળ્યો. પણ અને બરાબર યાદ છે કે ગુરુહેવ ખૂબ જ ઓઝું બોલે છે. જરૂર પડ્યે એકાદ-એ જીબન કે વાક્યથી જ પતાવે છે. તેમ છત્તાં અને તેમણે સોનેરી જલાદ આપ્યી, માર્ગદર્શન આપ્યું.

આટલું બોલીને તેમની આપ્યો. પણ બરાબર માટે મીંચાઈ ગઈ. જણે જનનીને વિનંતી કરતાન હોય કે આ બાળકને અપનાવી દો. થોડીવાર તેમના સાનિધ્યમાં બેસીને હું પાછો ફેરો. જીબા થઈને ગુરુહેવને મેં બે હાથ જોડી પ્રણામ કર્યાં ત્યારે તેમણે પ્રસાહાનાં એ પુષ્પો મારા હાથમાં મૂક્યા અને આદ્યિપની મુદ્રામાં તેમનો હાથ જાંચો થયો. તેમના મુખ પર હિંબ રિમત રેલાઈ આવ્યું. તેમની આંખોમાં અપાર કરુણા ધર્સની આવી. થોડી જ ક્ષણોમાં હું કિંભતી અજનો અને મળી જયો હોય તેમ મનમાં આનંદ, હળવાસ અને શાંતિનો અતુલવ થયો. નવી જ કિંભત અને હું સાથે ધંધામાં આગળ ધર્મવાની દિશા સંતોષી હોય તેવી અતુલ્લતિ થવા આગી.

પું ગુરુહેવ અને તેમણે આહેરોલ ગાયત્રી-ઉપાસનાથી સાત વર્ષોં સુધી વિમુખ થવા અને રહેવા બદલ હું અનેમન ક્ષોભ અતુલવવા લાગ્યો. માની જોડમાં બેસીને શાંતિ-હું અને સલામતીનેં જ્ઞાનંદ આણુંને બહસે, જગતજનનીને વિસારીને મારા પ્રેમ ખાતર હું ડેરડેર બટકતો રહ્યો પણ કાર્ય માર્ગ બલું થતું હેખાણું નહિ. આને થાણીને-હારીને, ગુરુહેવના માર્ગદર્શન માટે, જગતજનનીની જોડમાં બપાઈ જવા હું પાછો આવ્યો. ગુરુહેવના માર્ગદર્શનથી આત-આત વર્ષોનો બાબ તેમની બે જ ભિન્નિની મુલાકાતમાં જિતરી ગયો। ત્રીજી જ ભિન્નિટે અને ડાઈ જગતાથા પ્રાપ્ત થયાની અને એખા શીતળતાની-

છોપડાની અતુભૂતિ થવા લાગી, તત્કષ્ણ જ મને પૂ. શુરુદેવના માતૃસ્વરૂપનાં ફર્જિન થયો. બાળક ભૂલ કરીને મા પાસે પાછો આવે તો મા ટપકો આપે ને કદાચ એકાદ લપડાઈ પણ પહેલાં તો લમાવી હે, પણ આ તો સન્ત, શુરુ અને માતૃસ્વરૂપ. મારા વ્યર્થ હાંકા માટે મને એક હરા સરખો ય ન કઢો ! ? ને વેદજનનીએ મને તત્કષ્ણ જ અપનાની લાધો ! મારો લધો જ બોજ ઉપાડી લાધો !

આજે સાચે જ મને ભાન થયું કે, 'કુપુત્રો જાયેત કવચિદપિ કુમાતા ન ભવતિ ! '

કચારેક કુપુત્ર જન્મે છે, પણ માતા કદી કુમાતા નથી થતી.

આ જ અતુભવ સાથે મેં નિશ્ચય કરો કે પૂ. શ્રીના આહેશતું-પાંચ માળા કરવાનું - જાંપૂર્ખ નિષ્ઠાથી પાલન કરીશ. વેદજનનીનું શરણું કદાપિ ન છોકું તેવા મેં મનોમન શુરુદેવ અને માતાજીના આશિષ માટે પ્રાર્થના કરી. "



મા ગાયત્રીની કૃપા અને પૂ. શાસ્ત્રીજીના આશિષ અમ સૌ પર અવિરતપણે વરસતા રહેલી એવી અસ્થર્થના સહિત


## NARENDRA PROCESSING INDUSTRIES

Tele. : Factory : 41177 \* Resi. : C/o 42689



33-1, Plot No. 1, Behind Sub-Jail, Khatodra,  
SURAT - 395 002

## પૂજય ગુરુહેવના સાન્નિધ્યની પળોમાં....



**ગ્રૂપ** ક જાહેર રજના દ્વિસે સગારે અગિયાર વાગ્યાના સુમારે હું પૂ. ગુરુહેવના નિવાસરથાને દૂરીરમાં દર્શાન ગાટે ગયો. મુલાકાતીઓથી દૂરીર ભરાઈ ગઈ હતી. સૌ દૂરીરમાં બેઠાં હતાં. પૂ. ગુરુહેવ હજુ દૂરીરમાં બિરાજ્યા ન હોવાથી દિંચડા ખાલી હતો. દિંચડા પર રેશમી જાગમ અને અઢેવનાના તકિયા ગોઠવેલા હતા. એક દિંય યોગીના બેઠકનો દિંચડા પણ દિંયતાથી એપો રહ્યો હતો. એ દિંય દિંચડાને અનાયાસે જ મારાથી વંદળ થઈ ગયા અને છેક છેવાડે મારી જગ્યા લઈને બેઠો. સૌ ભાઈ-બહેનો ગુરુહેવના આગમનની રાફ જોઈ રહ્યા હતા. યોડી જ વારમાં ગુરુહેવ પધાર્યા બેઠે સૌઓ જિભા થઈને તેમને માન આપ્યુ. ગુરુહેવ દિંચડા પર બિરાજ્યા અને સૌને બેસી જવા મૂક સુચના કરી. એક પણી એક સૌઓ જિભા થઈને ગુરુહેવને પ્રણામ કરીને કરી પાછી પોતાતાની બેઠક લઈ લીધી. પૂ. ગુરુહેવ અને બહેને સૌના ખખરથાંતર પૂછ્યા.

યોડીવારે ગુરુહેવને એક ભાઈએ કહ્યું, 'ગુરુહેવ, હું તંહુરસત રહુ' એવા આશીર્વાહ આપે. અને તંહુરસત રહેવા માટે શું કરવું તે અંગે આધ્યાત્મિક માર્ગદર્શિન આપે. એવી મારી નામ વિનંતિ છે.'

[ આધ્યાત્મિક ડેડી, જુલાઈ, '૮૬

‘ભાઈ, તમે આજે પહેલીવાર આવો છો ?’ પૂ. બહેને પુછ્યું.

‘હાજી, બહેન, હું શરીરમાં પહેલીવાર આવ્યો છું. આજે આવી ગ્રેરથી જાગી તેથી કંઈક માર્ગદર્શિન અને સત્તસંગના આચારથી પૂછું છું. વળી અણી એડેલા બધાયને એમાંથી કંઈક ને કંઈક અણી રહેશે તેથી એ અંગે શુરૂદેવ કંઈક પ્રકાર પાડે તો સાચું.’ પેલા ભાઈએ જાબા થઈ એ હાથ લેડી સ્પષ્ટતા કરતાં છિંયું.

શુરૂદેવ થોડી ક્ષણે અનતમુખ બની ગયા. પૂ. બહેને આયેં બંધ કરી એસી રહેલા શુરૂદેવ સામે જેથું અને ધ્યાનમગ્ન શુરૂદેવના ધ્યાનમાં વિક્ષેપ ન પડે તેથી પૂ. બહેને ધ્યાનથી થોડીવાર થોબવા છિંયું. થોડીક જ ક્ષણેાર્થ શુરૂદેવ આયેં જોલી એટલે બહેને છિંયું કે ‘તંદુરસ્ત થવા અને રહેવા માટે આ ભાઈ આપની પાસે માર્ગદર્શિન માગે છે.’

એક આત્મીય રિમિત વેરી શુરૂદેવે છિંયું, ‘માતાજીનું શરણું સ્વીકારી લેઓ. માતાજી બધું જ સાચું કરશે.’

‘હા, એ તો સાચું પણ આપ કંઈક વિગતે સમજાવો. તો આપનું ગાન અને વાણીનો લાલ પણ મને અને અમને શાતા વળે.’ પેલા ભાઈએ છિંયું.

શુરૂદેવ કહે, ‘ભાઈ મારી પાસે ડોઈ જ જીાન નથી. હું તો એટલું જ જાણું છું કે સૌએ માતાજી-પોતાના ધ્યાનની-શરણાગતિ સ્વીકારી અદ્ધાર્યોંક તેમનું રમરથું કરવું જોઈએ.’

આમન્તુકની ઉત્કટતાની પૂર્ણ કરતાં શુરૂદેવે છિંયું કે, ‘ભાઈ, માનવીના તન અને મનની તંદુરસ્તી માટે ગાયત્રી-મહામંત્રના અથવા પોતાના ડોઈ પણ ધ્યાનમંત્રના જ્યું સૌથી શ્રેષ્ઠ છે. હું અગાઉ અનેકવાર કઢી ગયો છું કે, મંત્રનો જ્યું કરવાથી આપણા શરીરમાં એક પ્રકારની ઝક્કિન નિષ્પત્ત જીવનની થાય છે જેના દારા આપણું તન-મન-સમગ્ર અસ્તિત્વ એક પ્રકારની સભરતાનો અનુભવ કરે છે.

પણ વાત આટલેથી જ અટકી નથી. શરીર અને મનની તંદુરસ્તી માટે માનવીએ ડેટ્લીફ આચારસંહિતા અને નિયમિતતા ફેણવવાની જરૂર છે :

(1) નિત્યકર્મનું પાલન : દરરોજ સુધેદાય પહેલા જાણું. શૌચ-સનાનાદિયી પરવારી સૌ પ્રથમ જ્યું કે ઉપાસના કરી લેવા, પણ જ ધરકામ કે નોકરી-ધર્માના કામે જવું.

રાત્રે સૂતાં પહેલા સહ-ધર્મેનું વાચન કરવું. ધરના સૌ સંધ્યાએ સાથે અણી સત્તસંગ કરવો, પ્રાર્થના કરવી.

(2) હુંમેશ સત્ય બોલવું અને આચરણ કરવું : રોજબનૈરોજના જ્યવહારમાં કે નોકરી-ધર્માના કામનાં કે ભિત્રો-સંભંધીએ પ્રત્યેના જ્યવહારમાં હી આસત્ય બોલવું કરવું નહિ. એમ કરવાથી વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વની છાપ ખોટી અને ખરાખ ઉપસે છે. એથી વ્યક્તિત્વનો હાંચ આય છે. સત્ય બોલતા અને આચરણ કરતા માનવીના વ્યક્તિત્વમાં એક પ્રકારની તેજસ્વિતા આવે છે. અન એકદમ ખુલ્લું-નિખાલસ અની જાય છે અને નિખાલસ મનનાં રૂપનોંનો શરીરમાં એક પ્રકારની તાજગી લાવે છે. આ વાણીનું એક પ્રકારનું તપ જ છે. સંખ્યિત વાણીથી આરોગ્ય પ્રાપ્ત થાય છે.

(3) કોષનો ત્યાગ : કોષ અમિ લેવો દાઢક છે. કોષ લેવો મહાન સત્તુ ખીને ડોઈ નથી. કોષથી અન અને શુદ્ધ અણાત અને અસ્થિર બને છે. તેવો માનવી ન કરવાનાં કાર્યો કરી જેસે છે. એથી સર્વત્ર વિખ્યાત અને હુંઘ જ ને છે. કોષી માનવી ભિત્રો-સંભંધીએ-રનેલીએ-સ્વજનેમાં સુદાં અપ્રિય બદ્ધ પડે છે. તેનાથી અધાર જ વિમુખ અની જાય છે. મનની અણાતિ અને અસ્થિરતાને કારણે પિતૃશુદ્ધ થાય છે. એમાંથી અનેક રોગોનો જરૂમ થાય છે. અણાત મનને કારણે નિદ્રા આવતી નથી.

આનિકાને કારણે શરીરમાં અજાપો લાગે છે. મન નિર્ભળતાને અનુભવ કરે છે. એટલું જ નહિ, એથે શરીર અને મનના અનેક વિકારો ઉદ્ભવે છે.

(૪) સંતોષ રાખવો : સંતોષી વૃત્તિથી શરીર અને મનની સથળી હિયા સંતુષ્ટિ બને છે. એ સંતોષ રાખવો : સંતોષી વૃત્તિથી શરીર અને મનની સથળી હિયા સંતુષ્ટિ બને છે. જેનાથી આરોગ્ય સચવાય છે. પણ 'સંતોષ' બોલવું અને રાખવો એ બિન છે. મનના અતિથી ઉદ્ભવતી તૃપ્તિનો લાવ જ સંતોષ' જન્માવી શકે.

(૫) ઈચ્છાનુસારી વૃત્તિ : કુદુંખ, મિત્ર, સ્નેહીઓ, સંબંધીઓ, સહકાર્યકર્તાઓ, નોંધરો વગેરની ઈચ્છાને પૂછું કરવાથી, તેઓને તેમની યોગ્ય-ઉચ્ચિત ઈચ્છા મુજબ અનુકૂળતા હોઈ આપવાથી પરસ્પર સહાયકવૃત્તિ જન્મે છે. બીજાનું કાર્ય કરવાની તત્પરતાથી આપણું મનમાં શાંતિ-આનંદ અને આત્મસંતોષનો ઉદ્ઘાટન થાય છે જે આરોગ્યમાં વૃદ્ધિ કરનારાં બને છે.

(૬) વ્યસનોનો ત્યાગ : વ્યસનો શરીરને અનેક રીતે તુકસાનકર્તા છે. વ્યસની માણુસ બેની આજુભાજુના સમગ્ર વર્તુળમાં તેમ જ કુદુંખમાં કલેશ, કુસંપ અને વિખવાદ જન્માવે છે. બડિતાતનો હાસ કરે છે. નાખુનો દુંહંખ કરે છે. વ્યસની માણુસ પોતાની જાત અને કુદુંખને અનેક રીતે હાનિ પહોંચાડે છે અને રોગને સામે ચાલીને નોતરે છે.'

ભિતબાષી સ્વભાવના શાશ્વતીએ આને ડોલેજના કોઈ ખંડમાં અભ્યાપક પ્રવચન આપત્તા હોય તેમ તંહુરસ્તી અંગે વિગતે સમજાયું, અને એકેલાએ પર તેમ જ પૂર્બા કરનાર ભાઈ પર જવિશેષ દાખિ હોઈ.

એકદમ એષું બોલનાર શુદુદેવે આને જાણે નાનકું બ્યાઘ્યાન આપી દીધું રેથી ઝૂટિરની સૌ ભાઈ-ખંડનો પર આશ્ર્ય છ્વાઈ ગયું હતુ. પદિયાળનો કાઢો સાડા બારનો. સમગ્ર બતાવતો હતો. ત્યા જ પૂર્બા કરનાર ભાઈ હોઈ જાઓ થયા અને કહ્યું, 'ખંડનજ હું કંઈક કહેવા માણું છું.' ચેલા ભાઈ એકદમ ગળગળા થઈ ગયા. ખંડન કંઈક કહે તે પહેલાં શુદુદેવે તરત જ સંભતિ આપી દીધી.

'શુદુદેવ, આપે વ્યસનોનો ત્યાગ કરવાની જ વાત હોઈ તેનાથી હું એકદમ સળગ બની ગયો છું. પ્રમાણિકપણે કહું તો મને દરરોજ વીસથી પરચીસ ઇપિયાના પાન ખાવાનો અને સિગારેટ ખીંચાનો શોખ છે. મને વારંવાર ફેસામાં અને દીતમાં ફુખાવો થાય છે. ગઈ કાલે સવારે સાત વાગ્યે સિગારેટ ખીંચાની પીતાં હું છાયું વાગ્યો રહ્યો હતો. મારી પતની જેસ પર ચા બનાવી રહી હતી. ધરના ચોકમાં રદ્દ પર નહાવાનું પાણી ગરમ થઈ રહ્યું હતુ. મારી પાસેથી આવીને સિગારેટના ખોખામણી મારા પાંચ વર્ષના બાળાએ કચારે સિગારેટ કાઢી તેની અખર ન પડી. સળગતા સ્ટલમાંથી તેથે સિગારેટ સળગાવી. રસોડામાં જઈ મારી પતનીને કહે, 'જો મર્યાદા, મને પરચાની જેમ સિગારેટ પીતાં આવણી ગયુ.' મારી પતની કંઈક પણ સમજે અને એકેલે તે પહેલાં તે મારી પાસે ઢાડી આવ્યો. મને વળગી પડયો ને હાથમાની સળગતી સિગારેટ બતાવવા લાગ્યો. હું તેના હાથમાંથી સિગારેટ છીનીની જેવા જાયો. ત્યા તેથે મારી પર સિગારેટનો પા કર્યો. સિગારેટ મને અયડાઈને નીચે પડી. મેં તેને પહીને નશ્ય-ચાર તમારા લગાવી દીધા. તે ઝૂસે ઝૂસે રડવા લાગ્યો. હેઠે હોઈ તેના ડિખાંના રોકાન નહીં. મારી પતનીએ મારા સિગારેટ ખીંચાના શોખ આડે બળાયો. વ્યક્તિ કર્યો. અને બાળાને મારવા બદલ તે પણ રહી પડી. સરારથી જ મન જિચા થઈ ગયો. પતનીનું પ્રેશર કો અઈ અણુ. તેને બદલ આવવાથી તે બાયો. ડિવસ સ્ફર્જ રહી. જાણે નોંધરીએથી ધેર આવ્યો. તોય મારી પતની મારી સારે રીચાયેલી હતી. કંઈક જોડું કર્યાતું મનમાં ચંદ્રચંદ્ર થવાથી અને અઈ કાલે બાયી રાત જાપ

ને આવી. આજે પણ મનતો અજ્ઞે દુર થતો નથી. અશોટ મનતે કારણે હું આપના દાંતેને અધીં આવતો રહ્યો. અધીં આવીને એઠા પણી અચાનક જ આપના આવવા પહેલાં મને આપને આવી વાત પૂછવાનો જરૂરકાર થયો. જેનાથી આપે મારી આંખ ઉધાડી નાખી છે. મને જાગ ફર્યો છે. મને આપ આશીર્વાદ આપો કે હું આ વ્યસનમાંથી મુક્ત થાઈ ને મારી પત્ની અને બાળકની સાથે સુખેથી મારો સંસાર વિતાયું.'

આટલું કઢી પેલા ભાઈએ આંખમાં આંસુ સાથે પૂ. ગુરુહેવના ચરણોમાં માથું મૂકી દીધું. ગુરુહેવ પેલા ભાઈને બરડે અને માથે હાથ ફેરાયો. અને કહ્યું કે 'આ જ ક્ષણથી પાન-સિગારેટને હાથ પણ ન આડાડવાનો સંકલ્પ કરી લો. જ્યારે એવી ઘણા પણ થાય ત્યારે મંત્રજપ ચાલુ કરી દેનો.'

આજના પ્રસંગથી અને વાતથી સૌ રતખ બની ગર્યા હતો. એથું બોલતા ગુરુહેવ આજે નાનકડું બાખ્યાન આપી દીધું એવું ને, આશ્રમ એઠેલા ભાઈ-અહેનોમાં જવાખું હતું તે તત્કષ્ણ જરૂર બન્યું. આંદર આંદર સૌ કંડેવા લાગ્યા હે, ગુરુહેવને આ વાતની ખરર પડી ગઈ હોવી જોઈએ તેથી જ તેના દ્વિતીને ખાતર તેમણે આટલી તરફી જીવી.

ગુરુહેવને જમવાનો સમય થયો. હોવાથી એમે સૌ જિંદગી.



શુદ્ધેચ્છા સહિત :

Re. : ૩૬૫૦૫  
Fact. : ૩૭૦૦૪

ડૉ. જયંત વાડીલાલ ગીલીટવાલા

૬૨૬૪ જાતનો જરી કસબ ગીલીટ કરનાર



# ડૉક્ટર જયંત ઈંગ્રીઝ્સ

બેનાગર જિલ્લેટ બનાવનાર

: ફોન્ટી :

ફોન્ટ નં. ૧૩/૧, અટાંશા  
ઉપનારોડ, સુરત

૪૪

: રહેઠાણ :

૬/૫૧૮ કોટખાલી રોડ,  
સુરત-૧

# આત્મગુજરાત - ૮

ડૉ. કાન્દિતલાલ કાલાણી

અજ્ઞાનને દૂર કરવા શું કરવું ? સંતસમાગમ, સત્યાસ્લોનો નિરંતર અભ્યાસ, અનુભવી પુરુષોના અંધોનું અખ્યાન, અંતર નિરીક્ષણ, બાલ જગત પ્રત્યે આખ-કાન ઝુલ્ખાં રાખવાં.

ચિન્તા એછી થાય તેનો ઈલાજ ખરો ? ચિન્તા વિશે વિશેષ ચિન્તન ન કરવું, અતિ વિચારો ન કરવા.

પરમાત્મા કોને સહાય કરે છે ? ઉદ્ઘરશીલને, સાહસિકને અને અઙ્ગાવાનને.

ખરું પુષ્ય કરું ? પરોપકાર. અને પાપ ? અન્યને પીડા આપવી તે.

અગવાન પ્રત્યે હૃદયમાં પ્રીતિ કેમ નથી જાગતી ? વિષયો પ્રત્યે લર્પૂર અનુરાગ છે એટલે.

અગવાન પ્રત્યે પ્રેમ જાગે તો શું થાય ? સંસાર પ્રત્યેની આસક્તિ છૂટી જાય.

ચિત્તને સમ અવસ્થામાં રાખવા શું કરવું ? કામ, કોષ, લોભ, મોઢ, મત્સર અને અવિદ્યા અથવા અજ્ઞાનના પ્રલાવથી દૂર રહેવું.

કામ એટલે શું ? વિવય જોગવાની ધર્મા, તૃષ્ણા, રાગવૃત્તિ, ધન્દ્રિયસુખ પ્રત્યેનું જેંચાણ.

કોષ એટલે શું ? ખાર્યું ન યવાથી કે ન મળવાથી યતો રોપ.

લોભ એટલે શું ? ન હોય તે મેળવવાની અને હોય તેને જાળવી રાખવાની લાલસા.

મોઢ કોને કહેવાય ? વિકિત કે પદાર્થ પ્રત્યે આસક્તિ.

મત્સર એટલે શું ? ગર્વ અથવા અભિમાન.

મત્સર કોને કહેવાય ? અન્યનું સારું ન સહન થઈ શકે તેને.

ધર્મરિપુઓનાં પ્રલાવમાંથી બચવા શું કરવું ? 'સ્વ'માં સ્થિર રહેવું.

સ્વ એટલે શું ? અહંરહિત આત્મતરપ

ને પોતાનામાં સ્થિર ન રહે તેને શું થાય ? ને બહિર્મુખ થાય છે તે વાસનામાં સપ્તાય છે, ને સ્વસ્થ નથી તે કોષ અને લોભનો શિક્ષાર બની શકે છે, અન્યમાં ધ્યાન જર્તા ગર્વ અને મત્સરને અવકાશ રહે છે.

'સ્વ'માં સ્થિર થવાનો ઉપાય શી ? વર્તમાનકાળમાં જીવનું એટલે ? ને કાર્ય હાયમાં લીધું હોય તેમાં સો એકા દૂખી જરૂર, તરવદર્શન વિના અન્ય કોઈ લગતી ન હોવી જોઈજે. આ જર્તમાં સર્વોપરી શક્તિનો સાક્ષાત્ગાર, કરવો છે એ જ માત્ર નિર્ણા હોણી જોઈજે, આદુંઅવળું જોયા વિના માત્ર અગવાનમાં જ નિર્ણા એટલે વર્તમાનમાં જીવનું, હાયમાં લીધેલા કાર્યને અગવદ્ધકાર્ય માની તેમાં લયકીન થઈ જરૂર, અગવદ્ધ ધર્માને આધીન થનું.

ઉપાધિઓમાંથી બચવાનો ઉપાય શું ? ખલા હે રેજા સપના-આ જગત રાત્રીના સ્વરૂપ નેવું જીબુંભંગુર છે એટલું ૬૬ થઈ જાય તો પણી ઉપાધિઓમાથી બચી જવાય.

આહીનાં સુખ-દુઃખને કેવી રીતે જોવાં? પડણ ઉપર ચિત્ર જોતા હોઈએ તેમ, (પડણ પરના કાઈપણું ચિત્રને આપણે પકડતા નથી, માત્ર જોઈએ છીએ.) સુખ-દુઃખને અળગા જીબાં રહી જોવાં, એને જ સમત્વ યુદ્ધ કહે છે.

વૈરાગ્ય કુચારે જાગૃત થાય? વિષયોની કદુતાનું જીબ થાય ત્યારે.

જીબત ધર્મ કર્યો? અન્ય પ્રાણીઓના દુઃખથી દુઃખી યવું અન્યના આનંદમાં આનંદ માણુંનો, ચાત પોતાને ઓળખે તે, વ્યક્તિના વિકાસને વેગ આપનાર શકતા, નિયમ કે સિદ્ધાત અભિજ્ઞાન કરેવાય? પરમાત્મામાં પરમ પ્રેમ, ભગવાન પ્રત્યે નિઃરવાર્ય સુદૃઢ રનેદ, પ્રાણીમાત્રમાં ઈશ્વરનું દ્વારા, 'હું'ને રથને 'હરિ' કેન્દ્રમાં.

અભિજ્ઞાનનું ઈણ શું? પરમાત્મા સાથે એકત્વ, નિર્બધતા, નિર્બંધ પ્રેમની પ્રાપ્તિ, સંસાર પ્રત્યે અનાસ્કિતનો ભાવ, નિમણતા, પાપનાશ, ભાવ, હિંયા અને પદાર્થ આં પરમાત્મા સાથે એકત્વ.

જીબ દ્વારા થવામાં શું આડું આવે છે? દદતાનો અભાવ, અથવા ચંચળતા.

માયા એટલે શું? અસત્યમાં સત્યનો આભાસ, સત્યમાં અસત્યનો આભાસ.

સર્વગ્રહું એટલે શું? તેજસ્વિતા, સંવાદિતા, વિશુદ્ધ રનેગુણ એટલે શું? ઈચ્છા, ગતિ, તાકાત, નિવૃત્તનો અર્થ? મૂળ સુક્ષમ ભણીની યાત્રા, પદાર્થમાથા આત્મા તરફનું આરોહણ.

સંસ્કાર એટલે શું? રમ્ભાતના સુદ્રા, ભૂતકાળના કાર્યોના રમ્ભાતનો સંચય

લુલનમાં શાંતિ અને આનંદ ટકાવી રાખવા શું જરૂરી? નિયમ, નિશ્ચય, નિષ્ઠા.

સાચું જીબ કર્યું? માયાના બંધનમાથા મુક્તા કરે, અણાનરૂપી અંધકારને દૂર કરે, પ્રકાશમાં રિથત કરી પરમાત્મા સાથે જોડે.

અન્તઃકરણમાં અનુકૂળ કે પ્રતિકૂળ સ્પર્ધનો કુચારે ન જીડે! નામ કેવળ વ્યવહાર માટે છે અને ઇપ્પ કાયમ રહેવાનું નથી એવા નિશ્ચય યાઈ જાય તો, તુચ્ચ-અરુચિ અને ગમા-અણુગમાના ભાવ-માથી છૂટા પડી શકાય તો.

સુવયન કોને કરેવાય? ને વચ્ચન ગંભીર અને અર્થસભર હોય, સાર વાળું, ઈણુંપ્રિય, ભિતભાષી અને સંદેશ વિનાતું હોય.

આત્મધનને દૂર કરનારાં સાધનો કયાં? સર્વત્ર પરમાત્માનું દ્વારા, નિરંતર પ્રભુભક્તિ, દનનો સમજપૂર્વકનો ર્વીકાર કરી જાતિ જળવણી, આકાશાઓમાંથી નિરુત્તિ, સંયમશીલ વાણી, સહન-શીલતા, જોડાત સેવન, સમભાવ-સમદાય, નિર્વેરતા.



મા ગાયત્રીની કૃપા

શ્રી ગણેશ ટ્રોડસ

‘ભ ગ વ તી’



દદવાડા-Rસ. ૩૬૬૧૮૫



## ભક્તિ એ જ સર્વાશ્રેષ્ઠ માર્ગ છે

**૫.** ગુરુદેવ સર્વને એક જ વાત કહે છે કે,

અદ્ધાપૂર્વક શરણાગતિ સ્વીકારી ત્રિપદા ગાયત્રી

મહામંત્રની ત્રણ માળાને હૈનિક કાર્યક્રમમાં વણી લે. આ પ્રકારનો કુમ આદરવાથી મતુષ્યનું ચિત્ત ધીમે ધીમે પોતાના છદ્માં ક માતાજીમાં લીન થના માર્ગ છે. તેનામાં આપોઆપ સમર્પણની ભાવના લગે છે. તે મનથી એમ સમજવા લાગે છે ક મેં મારું સર્વસ્વ માતાજીનાં ચરણોમાં જ સોપી દીખું છે. મને કાઈ જ દિક્કર નથી. સમર્પણના આ ભાવ દ્વારા પરમતરલ સાથે, આ ગાયત્રી સાથે એક પ્રકારથી અતું સંબંધાન આપોઆપ થઈ જાય છે, જેને પરિણામે પ્રલુબે-માતાજીએ પોતાના શરણાગતનું સર્વ રીતે થેય અને હિત સાખવું પડે છે.

આથી જ જીવનના રોજઘરોજના વ્યવહારમાં ઉદ્દેશ્વતી નાની-મોટી મૂંડવણો-આપત્તિઓભાથી તે માર્ગ કાઢી શકે છે, ઉકેલ મેળવી શકે છે ને તેનો જીવનવ્યવહાર સરળ ને સ્વાભાવિકપણે બહેના માર્ગ છે.

આમ જીવનવ્યવહારની સંધારેલી સહજતા પણ મતુષ્યને પોતાના છદ્માં-માતાજીમાં વધુ ને વધુ શ્રદ્ધા પ્રેરે છે, પ્રોત્સાહન પ્રેરે છે. જીવનમાં તે આગળ ને આગળ વખતો રહે છે.

અતે પ્રસ્તુત કરેલો પ્રસંગ એ જ દ્વારાં છે કે જીવનના રોજઘરોજના વ્યવહારમાં ઉદ્દેશ્વતી સુશ્રેષ્ઠીઓનું માતાજીની શરણાગતિ સ્વીકારવાથી, અદ્ધા રાખવાથી કેવી રીત નિવારણ થઈ જાય છે।

ધાટકોપર(મુંબઈ)થી શ્રી કાર્તિકુમાર શાહ લખી જણાને છે કે, પૂ. ગુરુદેવના આશીર્વાદ અને મા ગાયત્રીની કૃપા તો અપરંપાર છે: તેમના જેટલા ગુણ ગાઈએ તેટલા આછા છે. મારા ઉપર પૂ. ગુરુદેવની તથા માની કૃપા થઈ અને જે હિંય આનંદની અનુભૂતિ થઈ તે લખવા મને પ્રેરણા મળ્યા. ચારેક વર્ષ પહેલાં હું 'સંહેશ'માં 'અગોયર મનની અનયાણી'ના લેખેએ વાચ્યો રહ્યો અને માને વંદન કરતો. ત્યા સુધી હું માળા કરતો નહોતો. મને જાણવા મળેલું કે, ગુરુ વગર આપેલ મંત્ર અથવા માળા નિરયંક છે. મને પૂ. ગુરુદેવને મળવાનું ખૂબ જ મન થયું. પહેલી વાર હું મોડો પહુંચાયી ગુરુદેવની સુલાક્ષણ ન થઈ શકી. છતાં હું હિંમત ન હાથેં. થોડાક સમય પછી પૂ. ગુરુદેવ મુંબઈમાં આવવાના છે તેવું પેપરમાં વાચ્યું. તે સમયે સર્વિસમાથી એક દ્વિસની રણ લઈ. પૂ. ગુરુદેવને મળવા આતુર બન્યો. તેમને મળાને આશીર્વાદ લીધા અને તે દ્વિસથી ત્રણ માળાનો મારા કુમ અની ગયો.

ત્રણુક વર્ષ પહેલાની વાત છે. મારી પત્નીને અચાનક છાતીમાં દુખાવો જરૂર થવાથી તકલીફ થઈ. આ અગાઉ કચારેય પણ આ તકલીફ નહોતી. અમારા ફેઝિલી ડોક્ટરની દ્વારા ચાલુ કરી. કાઈ જ કરે પડ્યો નહિં. મોટા ડોક્ટરને ખતાંધું. કાર્ડિયોગ્રામ લીધો. તો નિદાન થયું કે હસ્તમાં લોહીનું ભરમણ બરાબર થતું નથી. તેમના સૂચન મુજબ દ્વારા ચાલુ કરી. પંદર દ્વિસ પણી દરીથી ખતાવવા વધા કારણ કે દ્વારાની કાઈ જ અસર નહોતી. તેણે તપાસીને હું કે કેસ સીરિયસ છે. તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી. સંપૂર્ણ આરામ કરવાનું કર્યું. પંદર દ્વિસ પણી રણ આપી. મારી માળાનો કુમ ચાલુ જ હતો. મંત્ર લખવાનું પણ ચાલુ કર્યું. મને મા ગાયત્રીમાં અલૂટ અદ્ધા હતી. ડોક્ટરે દ્વારા લખી આપી. દાદર ચાડ-ઉત્તર કરવાની સંપૂર્ણ મનાઈ કરી. પરમાં હું એકદો હતો. મારે આ-ખાપ કાઈ નથી. મા ગાયત્રીને ભરાસે હતો. પૂ. ગુરુદેવને મળ્યા વાત જણાવી, જીવનજળ લીધું.

[ આધ્યાત્મિક ફેલી, જુલાઈ, '૮૬]

સંપૂર્ણ : આરામ થઈ ગયો. ડોક્ટર પણ આશ્રમચિત થઈ ગયા. મારી ઉપર મા જાયત્રીની ફૂપા હતી અને પુ. શુરુહેવના આશીર્વાદ હતા.

તે જ અરસામા હું જ્યા સર્વિસ કરું છું તે જગ્યાએ રદાદમા યુનિવર્સિટી બનાવવું તેવી વાતો થઈ. મેનેક્ઝેન્ટમા મારું નામ સંડોવાયું. અને નોકરીમાથા ડિસમિસ કરવાનું પણ નક્કી થઈ ગયું. આ સમાચાર સંભળી હું ખૂબ જ મજબૂરી ગયો. માને જસ્તા વિનવણી કરી કે, મા તારા બાળકની લાજ રાખજો. સાચે જ માએ મારી લાજ રાખી.

હોડે વર્ષ પહેલાં મેં દેશમાથી મારું એક જૂનું ધર વેચી હીથું હતું. છ્યાંને લીધે મારા સમા કાકાએ મારી સામે કેસ હોવો. ધર તો મારા નામ ઉપર હતું. એમાં પણ માએ મારી લાજ રાખી. હું કેસ જીવી ગયો અને નિર્દોષ સાબિત થયો, મા હાજરાદજૂર છે. આ કળિયુગમા આપણને સાક્ષાત્કાર થતો નથી. પરંતુ ધૂપી રીતે પ્રેરણા તો મળતી જ રહે છે.

આ જાયત્રી હેવેની પણ હેવી છે. તે ખૂબ જ દ્વારા છે. અદ્ધા રાખી અકિતા કરવાથી જરૂર જીવણતા મળે છે. મા બાળકનું કહી પણ અહિત કરતી નથી.

પુ. શુરુહેવ એ મા જાયત્રીનું સાક્ષાત્કાર ઇપ છે. માએ તેમને આ કળિયુગમા એક મનુષ્યના ઇપમા મોહસ્યા છે. તેમાં નિઃસ્વાર્થ લાવે માર્ગદર્શન આપે છે. તેમનું કાપમ હસ્ત મેં એ જ એક દીર્ઘનું અડધું દુઃખ ઓષ્ઠું કરે છે.

ધીણી વખત માળા કરતી વખતે મન ખીલ રરતે હોરાઈ જાય છે પરંતુ આંખ ખોલી માની છીએ જ્ઞાને જોતાં મન બરાબર થઈ જાય છે, એકાગ્ર ચિત્તે માના ખ્યાનમા લીન થતી લાગે છે કે જીવનમા હોઈ જ નથી, નિરસ છે. અકિતા એ જ સરંશેષ માર્ગ છે. એકાગ્ર ચિત્તે રમરણ કરવાથી માનસિક શીંગતિ તો જરૂર મળે જ છે. એ મારો જાત અનુભવ છે.

પુ. શુરુહેવ જને મા જાયત્રીના મારી ઉપરથી ઉપકારો છે અને તે સર્વે અહીં વર્ણવા જોવું નથી.

પુ. શુરુહેવ તેમ જ માની જાહી અમાપ છે. મા જેમ બાળકની સંભાળ લે છે તેમ મા જાયત્રી પણ વિપરીત પરિસ્થિતિમા આપણી પડ્યે રહે છે. મા જાયત્રી તેના બાળકનું કહી પણ અહિત બાબા હેતી નથી.

અદ્ધાપૂર્વક અકિતા કરવાથી - એ આખા હિવસમા અડધો કલાક મારું ખાનપૂર્વક રમરણ કરવાથી જરૂર અનુભવ થાય છે.



મા જાયત્રીની ફૂપા અને

પુ. શુરુહેવના આશીર્વાદ હરદાશ  
વરસતા રહેલા એવી નમ વિનંતી સહ  
જમનાદાસ નાગરદાસ મેઢી

જનરલ મરચન્ટ

‘ભગવતી’

દિવાઢા - R. No. ૩૬૧૧૮૫ (ડિ. વલસાડ)



# શ્રીમતી ગોપનીય

પ્રશ્ન : ઉપવાસનું મહત્વ થું છે ?

ઉત્તર : ઉપવાસને આપણે બહુ સીમિત અર્થમાં લઈએ છીએ. સામાન્ય જનતે મન ઉપવાસ એટલે જમવું નહિ તે અથવા કેવળ ઇણાહાર જ કરીને દિવસ પસાર કરવો અથવા એ રીતે કાઈ પત કરવું. ઉપવાસનો આ એક અર્થ છે.

કેવળ પાણી પર હેઠળ પર રહીને ઉપવાસ કરવાનું સર્વશ્રેષ્ઠ છે પણ એ શક્ય ન બને તો એકાદ વાર ઇણ બદ્ધ ને અથવા ઇણાહાર કરીને ઉપવાસ થઈ શકે છે. ઇણાહાર ખૂબ જ સારો ને મનતે સ્વૂર્તિભય રાખે તેવા હોવો જોઈએ. આ ઉપવાસ કરવાની રીત થઈ.

આરોગ્યની દિલ્લિએ આ ઉપવાસ કાઈ અંશો યોગ્ય કરી શકાય.

પણ મને આ વાત બહુ ગળે જિતરતી નથી.

બ્યક્ઝિતગત રીતે હું ઉપવાસનું કાઈ મહત્વ જોતો નથી. તેમ કાઈ ને ઉપવાસ કરવાનું કહેતો પણ નથી. કારીર અનુભય છે. તેને-શરીરને-અનુની સતત જરૂર રહે છે તે તેને આપવું જ જોઈએ.

ઉપવાસ કરનારે પોતાની અક્ષિતનો સૌ પ્રથમ ઘ્યાલ કરી લેવો જોઈએ. કેટલીક બ્યક્ઝિતએ. એવી હોય છે કે જેમને ઉપવાસ કરવાથી, એક વાર જમવાથી કુશ્યા રહેવાથી કારીરને કાઈ પણ જાતની અસર થતી નથી. તેનું કારીર અને મન સતત સ્વૂર્તિલું અને અક્ષિતસંપન્ન રહે છે, તેવાઓને આરે જેમની ઘરણા હોય તો જેમ ઉપવાસ કરે કે એકવાર જમે. પણ કેટલીક બ્યક્ઝિતએ. એવી હોય છે કે, જેમનાથી જરા પણ ખૂબ્યા રહેવાનું નથી. કેટલાક ભર્યે ભાણે એકવાર પૂરેપૂરું જમી શકતાં નથી હોતાં અને કટકે કટકે આવાની, નારતો કરવાની ટેવ હોય છે. આવાઓને ઉપવાસ કરવાનું કે એકવાર જમવાનું કરી ન શકાય. તેઓએ એ પ્રમાણે કરવું પણ ન જોઈએ. એટલે ઉપવાસ કરવા કે ન કરવા તે દરેક બ્યક્ઝિતની સ્વેચ્છાની વાત થઈ.

પણ ઉપવાસ કરવા અનિવાર્ય હે આવશ્યક જ છે એમ હું નથી કહેતો.

આપણે ત્વા અમૃત વારે, વતમાં કે નવરાત્રમાં લોડા ઉપવાસ, ઇણાહાર કે એકટાણું કરે છે. પણ એ કરતી વેળા પણ પોતાની ક્ષમતાનો ઘ્યાલ આવશ્ય પહેલો રાખવો.

આરી દિલ્લિએ કાઈ પણ વાર કે વતમાં કેવળ ઉપવાસનું મહત્વ નથી. તેનું આધ્યાત્મિક-ઉપાસના-ક્ષીય મહત્વ પણ ક્ષમતા લેવાની જરૂર છે. અને એને અનુસરવાની, તિથાપૂર્વક એનું પાલન કરવાની વિરોધ આવરણકારી મને લાગે છે.

દા. ત. સોભવાર કે ગુરુવારે પણ પોતપોતાની ભરજ સુજાપા ઉપવાસ કરે છે કે એકવાર જમે છે. એ જે કરે, પણ એટલેથી જ વાત અઠકતી નથી. સોભવાર મહાદેવજીનો વાર ઘણાય છે. તે દિવસે શ્રદ્ધા, અક્ષિત, પ્રેમ ને શરણાગતિપૂર્વક શિવનું પૂજન-અર્થન-રમરણ ને જે નમઃ શિવાયના જ્યો થાય, દિવસ આયે. એના જ તન-મનથી દરતા, દરતા, એકતા, જિઠતાં પસાર થાય તે વિરોધ મહત્વનું છે. શિવજી બોળા કહેવાય છે. તેમના એ બોંગપણને અપનાવવાનો જમા અસ્તિત્વને નિર્મણ ને નિખાલથ જનાવવાનો પ્રયત્ન પણ આદીથું દો સોભવારનો ઉપવાસ કે વત ક્ષમતા થયા લેખારી.

[ આધ્યાત્મિક ડેવી, કુલાઈ, ૧૯૬૫]

એ જ રીતે શુદ્ધારે શુદ્ધમંત્ર ને શુદ્ધવાણીનું સંનિષ્ઠાથી અનુસરણ કરવામાં આવે એ જ એનું વિરોધ મહારવ છે.

બાકી ડેવળ ઉપવાસથી તો કોઈ જ અર્થ સરતો નથી કે સરશે નહિ તેવું ભાડું આનવું છે.

આથી આગળ વધી થોડીક વિસ્તૃત રીતે ઉપવાસને સમજવાને। પ્રયત્ન કરીએ તો ઉપવાસ એ ભાનવીના ચિત્તને-ઇન્દ્રિયોને સંયમિત ને સમતોલ બનાવી શકે છે. ભાનવીના મનની વૃત્તિઓ, પ્રવૃત્તિઓને અંતમુખી બનાવી શુદ્ધની વૃદ્ધિ, દોષનો પરિણાર થઈ ને ચિત્ત, સમગ્ર અરિતત્વ પ્રભુમા-ધ્રષ્ટમા-માતાજીમાં લીન બની રહે એ જ સાચો। ઉપવાસ ને ઉપવાસની પ્રક્રિયા, તેનું મહારવ છે.

**પ્રશ્ન :** આધ્યાત્મિક પુરતકોના વાચન વેળા આત્માની જગૃતિની વાત આવે છે, તો આ આત્મ-જગૃતિ શું છે? દરેક મનુષ્ય આત્મજગૃતિ કરી શકે ખરો? એ કઈ રીતે થઈ શકે? આત્મજગૃતિનું ભાન આપણુંને થાય શ્વરું?

**ઉત્તર :** તમે સરસ સત્ત્વાલ કર્યો છે. તમારો પ્રશ્ન જ જગૃતિની લક્ષણો દર્શાવે છે.

આત્મજગૃતિ શબ્દ મોટો છે પણ એનો અર્થ સરળ, સહજ અને ભાવગમ્ય છે. તેનો નિગતે ઘ્યાલ મેળવવાને પ્રયત્ન કરીએ

આત્મજગૃતિ એ ભાનવીની જિજાસાવૃત્તિ છે, (જાણવાની ધર્માદ્ધા), જાણકારી, અને સળગતા છે. જાણકારી અને જિજાસાવૃત્તિને જીવન, મૃત્યુ, સંસાર, જગત અને આધ્યાત્મિકતા તેમ જ ધૂખરીય સુંદર્ભમાં વિશ્વાળ દર્શિએ જોવા, સમજવા ને મૂલ્યવવાની રહે છે.

ભાનવી ભાત્રમાં જિજાસાવૃત્તિ પડેલી હોય છે. કોઈ પણ વરતુ, પદાર્થ કે પ્રાણી ભાત્ર માટે મનુષ્યના ચિત્તમાં સહજ ભાવે જ કુતૂહલ પેદા થાય છે. ભાનવીનું આ કુતૂહલ ઈશ્વર, ઈશ્વરની લીલા સસું આ જગત તેમ જ અન્ય અનેક આધ્યાત્મિક ઈશ્વરીય બાધતો પરત્વે ઉદ્ભાવે છે, ત્યારે તે આત્મજગૃતિ તરફ વળે છે. આ પ્રારંભિક અને શાખિક સમજ થઈ.

સંસારસમાં રચ્યાપદ્યા રહેતા મનુષ્યને જીવનના કલ્યાણનો ઘ્યાલ આવતો નથી. પોતાના જ શ્રેષ્ઠની તેને ખરીર નથી. ભાનવી માત્રે 'સ્વ' અને 'પર'ના શ્રેષ્ઠનો ઘ્યાલ કરવો આવશ્યક છે. આ ઘ્યાલ આપ્ત કરીને 'સ્વ' અને 'પર'નું કલ્યાણ કરવાની, શ્રેષ્ઠ જાણવાની ભાવના જગે ત્યારે આત્માની જગૃતિ થઈ જાણાય.

પરમાત્મા મનુષ્યને ચોક્કસ હાલતમાં, તેના સહ-અસહ સંરક્ષારોની સાથે પૃથ્વી પર મોકલે છે. એ એ સહ-સંરક્ષારોની ભાવજગત અને અસહ સંરક્ષારોના નિર્ગમન માટે ભાનવીએ પુરુષાર્થ કરવાનો છે. આત્તર શુદ્ધસમૃદ્ધ લઈને આત્મિય અંશ્વર્ય સાથે ભાનવીએ પાણા સ્વ-ધામ સિધાવવાનું છે. ભાનવીએ આત્મિય અંશ્વર્ય માટે 'કંઈક' કરવાનું છે. આ 'કંઈક' એ શું છે તેની જાણકારી સળગતા ભાનવી પ્રાર્થ કરે ત્યારે તેની આત્મજગૃતિ થઈ ગણ્યાય.

આ જીવન અને સંસાર નાશવંત છે. શરીરતું આ પ્રાણિયું એક હિવસ વહેલું કે મોકું નિયેતત-પ્રાણીન થઈ ને ભાઈના ભણી જવાનું છે. ભાનવીય સધળા સંયંધો જરૂરાતુખન્યે જ જાણી મળેલા છે. એ જરૂરાતુખન્ય પૂરા થતા જ સંયંધાની લીલા સંક્રાંતિકા જવાની છે. સગાસંયંધી જી સ્વાર્થના જ છે. એક ભાત્ર માત્ર સાચો જગે પરમાત્મા જ છે. એવું તીવ્ય ભાન થવું જરૂરી છે. એ જ જાણી આત્મ-જગૃતિ છે. અંતરમાં તીવ્ય ભાવના જગે કે ડેવળ પરમાત્મા સાથે જ જરૂરાતુખન્ય જગે અને ઈશ્વર અનુભૂતિ છે. અંતરમાં તીવ્ય ભાવના જગે, જન્મોજન્મ પ્રભુતી-માતાજીની નિશામા જ વાતે, તીવ્ય ને ઉત્તેજ ભાવના રહે, અવોદ્ધ સુધી ટકી રહે, જન્મોજન્મ પ્રભુતી-માતાજીની નિશામા જ વાતે, તીવ્ય ને ઉત્તેજ ભાવના જ્યારે જરૂરમાં-અંતરમાં-સમરત અરિતત્વમાં જગે તેને જાણી આત્મજગૃતિ કહેવાય છે.

કેટલાક માનવીઓ આત્મજગૃતિ પૂર્વના સંરક્ષાર બળ સ્વયં જ ઉદ્ઘાસ્તી હોય છે. જ્યારે કેટલાકને આત્મજગૃતિ માટે પ્રયત્ન કરવો પડે છે. માતાજીમાં સંપૂર્ણ શક્તિ અને શરણાગતિ વડે જ આત્મજગૃતિનો આવિજ્ઞાવ થઈ શકે છે. કથા-પ્રવચનોનું અવશ્ય તેમ જ આધ્યાત્મિક-ઇશ્વરવિષયક અથેના વાચનથી અનુભૂતિ કુમશ: આત્મજગૃતિ આવી શકે છે પણ એ બાધતમાં આપણે મેટે લાગે થણું જ એદ્વરકાર રહીએ છીએ. સામે થાળી પીરસેલી હોય પણ જૂખ ભાંગવા ડાળિયો મેદામાં મૂકવા જેઠેલો તો પુરુષાર્થ આદરવો જ પડે, તેમ જ કથા પ્રવચનનો આધીની-સહાયથોના વાચનમાંથી આપણે કથું જ મેળવવાનો-સમજવાનો કે એનું અનુસરણ કરવાનો પ્રયત્ન કરવો પડે કે જોઈએ, કે આપણે નથી કરતા. જ્યારી કથા-પ્રવચનો સાલળવા ગયા ત્યાતું ત્યા જ મૂકીને ભાલી મને-ચિંતે આપણે પાછા આવીએ છીએ. પુરતકમાંનું હાન વાચીને પુરતક બંધ કરતા જ તે હાન બંધ કરી દઈએ છીએ એમાં શક્તિ અને શરણાગતિની અનેક વાતોની વિવિધ રીતે છણાવટ કરી સમજાવવાનો પ્રયત્ન કરેલો હોય છે. માનવમનના વેર, ઝેર, ધર્મ, અહંકાર અનુભૂતિ માટે અનેક રીતે ખતરનાક છે. એની સરસ રીતે સમજવા કરી હોય છે પણ એ સાલળાને કે વાચીને આપણે શક્તિ અને શરણાગતિના ભાવને જન્માવવા કે દઢીભૂત કરવા પ્રયત્ન કરતા નથી તેમ જ વેર-ઝેર-ધર્મ અને અહંકારથા વેગળા રહેવાનો કે બનવાનો પણ પુરુષાર્થ આદરતા નથી.

માનવી જ્યારે એમાંથી બોધપાઠ મેળવી જીવનમાં એનું તીવ્રતાથી અનુસરણ કરવા પ્રેરાય કે અનુશરણ કરે ત્યારે માનવીનો આત્મા જગૃતિ થયો કઢી શકાય.

જુન અને સંસારની ઔતિક કામનાઓ-લાલસાઓ નાચ પામે, અનુભૂતિ સંસારમાં જળકમળવતું રહે અને જીવન તેમ જ સંસારને સંપૂર્ણતા: આધ્યાત્મિક અને ઈશ્વરાલિસુખ બનાવે ત્યારે તેનો-અનુભૂતિ-આત્મા પરમ પ્રેમના પ્રકાશથી જળાણા થઈ ઉઠશે. તેના સમગ્ર અરિતત્વમાંથી બધા જ પ્રકારની ઔતિકતાઓ નાચ પામી કેવળ એક માત્ર પોતાના ધાર્યાનું-માતાજીનું જ શરણ અને સમરણ ઉદ્ઘાસ્તી રહે તેને જ જાગ્યા અર્થમાં આત્મજગૃતિ કહેવાય.

આ આત્મજગૃતિ દરેક વ્યક્તિ કરી શકે છે. બલ્કે દરેક આત્મજગૃતિ માટે પુરુષાર્થ કરવો જોઈએ એમ કું માતું છું. એમાં કથું જ અધરું નથી. કેવળ એને માટે તીવ્રતા, ઉત્કટતા અને ઉત્કંઠા જ જરૂરી છે.

આત્મજગૃતિ પામેવા મનુષ્યોમાં દુનયી કોઈ ભાષ્ટોનો રસ રહેતો નથી. તે પ્રત્યેક ઔતિકતાથી પર બની જાય છે. તેનું ચિંતા સદ્ગુરુ પ્રશન રહે છે. કોઈ પણ પ્રકારની આડકાશા કે લાલસા તેને રહેતી નથી. તે અંતર્મુખ બની આત્માનન્દમાં દૂધી જાય છે. તેના અરિતત્વમાંથી પ્રેમની, માનવતાની, સેવાની અક્ષિણી અરિતતાનો એક પ્રવાહ સતત વહેતો રહે છે. તેનામાં અહંકાર હોતો નથી આવી આત્મજગૃતિ તો કોઈ વિરલે કે સિદ્ધપુરુષમાં જ જોગ મળે પણ પ્રત્યેક સંસારી આવો પ્રયત્ન પણ આદરસી તો અનું સાર્થક બેખાયે.

એમણે આ સવાલ ઉપરિથિત કરેં છે તેનામાં આત્મજગૃતિનો એક જખાન જોઈ શકાય છે. એ જખાન પૂર્ણ પ્રનન્દિત પ્રકાશનું હેઠ કારણ કરે, એ પ્રકાશમાં આત્માઓ એટેલા પરમાત્માના-માતાજીના જીવન કરવા અધિકારી બને તેવા મારા આરીનો છે.

જી પ્રશ્ન : હાન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય છે?

ઉત્તર : હાન પ્રાપ્ત કરવા માટે શક્તિ અને શરણાગતિની પ્રયત્ન આવશ્યકતા છે. માનવીઓ જ્યારી સુધી શક્તાનો જંપૂર્ણપણે પ્રાદુર્ભાવ નથી થતો ત્યા સુધી તે હાન તો થાયા, કૂરી બદામે એ મેળવી શક્તાનો

નથો. ખોજું, શાન મેળવવા માટે નભના અને વિવેક જરૂરી છે. જિયાસા, કુતૂહલ અને ઉત્કૃષ્ટ શાનની શ્લિતિને ઉપાડી આપવામાં અનેક રીત મદદ રૂપ બને છે.

કેવળ દિનોસેહને ડહેળનાથી કે વાદવિવાદી ફરી શાન પ્રાપ્ત કરી શકતું નથી. તેમ જ તર્ફને અર્થાથી પણ શાન પ્રાપ્ત કરી શકતું નથી. તેથી શાન પ્રાપ્ત કરવાની ધ્રુવા ધરાવનારે તેનાથી સંપૂર્ણ પણ દૂર રહેવાની જરૂર છે.

શાન બે રીતે પ્રાપ્ત કરી શકાય છે : કથા-પ્રવચનોના અવષ્ટ દારા, સહભાગોના વાચન-મનન-ચિંતન દારા અને સત્પુરુષોના સહવાસમાં આવવાથી કે રહેવાથી માનવીય જુદ્ગિમાં સત્ય હકીકતોનો પ્રકાશ રેખાતો જાય છે.

ખીજુ રીતે સ્વાતુભવ દારા શાન પ્રાપ્ત કરી શકાય છે.

ઉપરોક્તા ને હકીકતો જણ્ણાની તેનાથી બદ્ધિને સત્ય હકીકતની કેવળ જાણુણારી પ્રાપ્ત થાય છે. એ જાણુણારી પ્રાપ્ત થાય પણ એને આધારે એનું આચરણ-અનુસરણ કરવાથી જીવનમાં વિવિધ જીતિક-આભાસિક અનુભવો થાય છે. એ અનુભવોને આધારે માનવીના શાનની સીમાઓ વિસ્તરાતી જાય છે.

એક વાર માનવી ઈશ્વરના અર્થિત્વ, તેના પ્રત્યેની શ્રદ્ધા અને શરણાગતિપૂર્વકની ભક્તિ અને તે દારા સ્વધારું માનવીનું જીતિક અને આભાસિક કલ્યાણ-શ્રેયની કેવળ હકીકત કે જાણુણારી પ્રાપ્ત થાય પણ માનવીના હૃદયમાં પોતાના છાટ પ્રત્યે શ્રદ્ધા, પ્રેમ અને શરણાગતિનાં અંકૂર ફૂલી તે વિસ્તરાતી જાય ત્યારે પરમતત્વના કૃપાશિષના અનેકવિધ અનુભવોનો માનવી અધિકારી બને છે; જેના દારા ઈશ્વર અને ભક્તિ કે ઉપાસના જાગેનું નવનીત તે સ્વાતુભવ દારા જ મેળવી લે છે.

અનુભ્ય સ્વક્રીય શ્રદ્ધા અને શરણાગતિ વડે છાયાની કૃપા પ્રાપ્ત કરે ત્યારે પ્રભુ પોતે જ પોતાનું શાન પોતાના શરણાગતમાં પોતાના ઉપાસકમાં સંકાન્ત કરે છે. આમ શ્રદ્ધા વડે માનવી-ઉપાસક પ્રભુ અને પ્રભુનું શાન અને પ્રાપ્ત કરી લે છે. જેમ જેમ માનવીની ભક્તિ વધતી જાય તેમ તેમ તેના શાનમાં પણ વૃદ્ધિ થતી જાય છે. કાળાતરે તે ભક્ત અને શાનીનું બિનુદ પામે છે. પણ એ ભક્તિ અને શાન ‘રૂ’ અને ‘પર’નું કલ્યાણ સાથે ત્યારે જ તે પરિપૂર્ણ બને છે. સાથે જ એક ખીજો નિર્દેશ કરું કે નિખાલસ, પવિત્ર અને સાત્ત્વિક હિલના માનવીમાં જ શાનનો એ પ્રકાશ રેખાય છે.

કેવળ કથા-પ્રવચનોના આવષ્ટ વગેરે દારા અનેક વક્તાઓના વિભિન્ન ભતો સાંભળાને શૂંઘવાઈ જાય છે અને આ કરવું કે તે કરવુંની મૂંજવષ્ટ થાય છે. તેથી છાય પ્રત્યેની શ્રદ્ધા કેળવાય, ઈશ્વર છે, તેની પ્રાપ્તિ અભુષ રીતે બદ્ધ થકે છે, તેથી તેને આધીન રહીને જ જીવન જવનું એવી આત્મપ્રતીતિ જાય એટથું જ પૂર્ણ છે. આ આત્મપ્રતીતિ આત્મરાનનો ઉપાડ કરી આપશે. □

‘શુરુકૃપા હિ કેવલમ’

મી ના ટ્રેડ સ્રી

“શ ગ વ તી”

દેવાળ-Rs. 369984

# કરમાયેલું કૂલ્ય મ્રકુદિલાત ખન્યું !

સ્વ.

તેમણે પોતાના છષ્ટ પરમતત્વ સાથે જાધેલ આત્માનુસંધાન વળેરેની વાતો આપણે અનેક રથોને અનેક પ્રસંગોના સંદર્ભમાં કરી છે એશ્વલે એની વીગતોમાં અને નહીં જતરીએ. એથું જ નહીં, જન્તોના મુખમાંથી જે શંદ્હો સરી પડે છે તે ગમે તે રીતે પણ સાધાર થઈને જ રહે છે. ગમે તે રીતે પણ મનુષે જેને અનુસરું જ પડે છે, જે જેના બાબતમાં હોય છે.

અને કહેવાનું તાત્પર્ય તો એ છે કે, પુ. શુદ્ધેન પાસેથી પ્રાપ્ત થતા સખિયારાથી અત્યેક જ્ઞાગન્તું એંધું પ્રકારની રાહત મેળવે છે, પોતાની સાથે કોઈક છે એવી પ્રતીતિ મેળવે છે, પણ તો શુદ્ધેનને મોઢે જ કથી હે છે કે, 'તમે અમારું ધ્યાન રાખજો, તમે અમારી સાથે રહેનો?' બાળક પડવાની થીક ભાને અથવા બાળક જેની પાસે હોય તેને જેરથી વળગી રહે છે, તેમ આધિ-ધ્યાધિ-જીવાનિના તાપથી વેદજનની ગાયત્રીની ઉપાસનાના રાહને ચીંધનાર, તેની કૃપા પ્રાપ્ત કરાવવામાં નિમિત્ત ખનનાર જેવા આપણું નિરસ સંત પુ. શ્રી શુદ્ધેનના સખિયારાને પેલા બાળકની જેમ પછી રાખે છે.

આતાજીએ આહેશે કાર્યપદ માટે પુ. શુદ્ધેન જ્યારે પરદેશ લાય છે લારે તેમના સાનિન્ધ્યમાં દ્રાવતા પ્રત્યેક ઉપાસકને 'સ્વ'ના હિતની ચિંતા થાય છે. અમારું કોણું? અમારું હવે શું થશે? કંઈ પણ મુશ્કેલી આવશે તો અમે શું કરીશું? કયા જરૂર શું? કણે કરીશું? અમને કોણું આર્ગાંધ્યાન ઓપણો? કોણું મહાં કરશે? એવી નિરાધારતાના આવથી જણે ખધાના મોં પડી લાય છે. પણ અરા તો જોવે આવ રૂમુંથે શુદ્ધેન આગળ વ્યક્તા પણ કરી હે છે.

માતાજીના કાર્યપદ માટે પરદેશ જતા પુ. શુદ્ધેન માતાજીની પ્રેરણા, સંદેત અને શક્તિના બજે તુંપાંને આશીર્વાદ આપી કથી હે છે. 'હું અહીં જ છું, કાર્ય જતો જ નથી, તમારી જાથે જ છું. તમે જીતત માતાજીનું રમરણ ચાલુ રાખજો. મને યાદ કરજો. ગમે તે ઇયે આજી હું તમને જાંદાય કરીન.' ને કાર્ય કર છે તે ખુદ વેદજનની કરે છે, જેની આપણુંને ખર્યર નથી અને માતાજીએ પુ. શુદ્ધેનને માધ્યમ-નિમિત્ત ખનાર્યા છે એટસે જો પોતાની રજૂઆત તેમની આગળ જ કરે છે. શુદ્ધેન માતાજી જમણ મૂકે છે તે નિવિષ તાપથી જાંતપ્તોનો તાપ દૂર થાય છે.

જન્તોની વચ્ચેનો કથી અદર જતી નથી, પણ પ્રારખવગાત, માનવી વિપરીત ખજોમાં મુશ્કેલીએ, માતાજી સમક્ષ - શુદ્ધેન આગળ ખા નાખે છે, કે તમે તો આવું આવું કણું હતું ને આજ તો જિલ્લા દિલ્લા અઈ રહી છે. તમારા વચ્ચેનું શું? હિતના કંડાણમાંથી તીકળતી વેદનાનો આ ચુર માતાજી મુખી પહોંચે છે, માતાજી શુદ્ધેન દારા આર્ગાંધ્યાન આપે છે ને અનુભૂતના હિતની કંઈક વેદનાનો જીમી લાય છે.

‘એક વાર પદમાદુમારીએ પૂ. શુદ્ધેવના અમેરિકામાંના ડાર્યોન દરમાન અનુભવેલ પ્રચારંગ અને પ્રસ્તુત છેણી છે. નેમાથી જોને પ્રેરણું મળશે એવી આશા છે.

‘અમી વરસતા પૂ. શુદ્ધેવના પુનિત ચરણોમાં મારા સાધ્રાગ પ્રણામ. તા. ૧૩-૨-’૭૬થી પૂ. શુદ્ધેવના સાનિધ્યમાં આવ્યા, છીએ. અવારનવાર તેમની કૃપાના અનુભવેલ થતા રહે છે.

મારી મધ્યરના મામાનો દીકરો પ્રવીષસિંહ, ગામ ખંજરોલી, જિ. સુરત, જન્મથી જ અસ્થિર અગન્ધ, બગભગ આપેડ હંમરે પહોંચેલા, અચાનક એક દિવસ પરમાણી જતા રહ્યા. ખૂબ સોધયોળ હરી. અંતે સુરતથી પ્રચિદ્ધ થતા હેનિક ‘શુદ્ધરાતમિત્ર’માં હોયા સાથે લહેરાત આપી. મારા એક નજીબના ભગવાનાથી મને લથ કરવાંમાં આવી મેં શુદ્ધેવને વાત હરી તે વખતે બરાબર આડ તથું માનનો કામય વીતી ગયેલો. શુદ્ધેવે હણું, ‘હું પ્રયત્ન કરું છું! શુદ્ધેવને લથ કર્યા પણ એ ભાઈ એમની જતે જ ત્રૈવિસ દિવસે એમના મામાને ધેર ગામ સંચિયા સુકામે સવારે વહેલી પરોટે સીમભાણી આવતા દેખાયા. આટલા સમય દરમાન એમના શારીરિક દેખાવમાં ફરફાર થઈ ગયેલો. જેટસે બાબો આવે છે. અને છાઠરાં ખીશો, એટલે લાડી કદ્દને મારીને કાઢી મૂકવાના પ્રરાદાથી એમના મામા જથું છે, ત્યા જે ભાઈ બોલ્યા, ‘મામા’ અને આનંદ બ્યાપી ગયો. જન્મથી જ્ઞાનતંત્ર નથળાં હોવાથી એમની વાચા તથા જમજમાંકિત પણ નથી, જ્તા શુદ્ધેવ અને વેદમાતાની કૃપાથી બોલ્યા અને માર પડતો અટકી બયો.

મારાથી નાની ખહેન પ્રકુલ્ભા માટે મારા હાધર-મધ્યરને જતત દિલમા એવી ઘર્યા કે, જંસારી કુદુંબ અને ભૂરતિયો મળે તો જારું. સમય પણાર થતો હતો અને દિવસે દિવસે ચિંતા ધેરી જનતા હતી. પૂ. શુદ્ધેવની કૃપાથી જંસારી કુદુંબ અને ભૂરતિયો મળ્યો. પૈસે-ટક પણ સુખી છે અને જધાનો સ્વભાવ પ્રેમાળ છે. કુદુંબ ઈશ્વરપરાપણ છે.

અમય જતા મારી એનના જંસારશ્વી બાગર્યા તા. ૧૨-૩-’૮૪ના રોજ પુત્રશ્વી રૂલનો જન્મ થયો. કુદુંબમાં જધાને આનંદ થયો.

બાબાના જન્મ પણી ગણ્યતરીના યોડા કલાકોભાઈ જ મોટા માણ્ણસને પણ ન આવે જેટલા જોરથી હેડ્ડી અને બગભગ કલાક-એ કલાક જિવાય ધીમી પણ ન પડે. આ નિત્યક્રમ હતો. શુદ્ધેવનું અભિમંત્રિત જળ ચાલુ હતું. હંઈક અંશો રાહત જથ્યાતી હતી. દરેક રીતે શરીર આરાધ્યપ્રાણ હતું. બરાબર હોઠ માસ થયો તે જ દિવસે જવારે આડેના સુમારે નવડાવવા માટે હું નેવા ગઈ તો શરીર એકદમ એહેલા, હાયપગના પંલ કાળા પડતા હતા અને ઉચ્ચા આવવા મર્ડિયા. જીવનજળની અમગ્નિ મોના મૂળી, પણ વ્યથું. હોરપીટલમાં દાખલ કરતી ડોષ્ટરે હણું, ‘એકદમ ગંભીર હાથત છે આ તા. અલ્બાને તમે માનો છો?’ મેં હા હણું. ડોષ્ટર હણે, ‘તમે અલ્બાને યાદ હરો. હું આરવાર આપું હું. ઓઝલ હંઈ હી ના શકું.’ મારા પ્રેણામાં જ બાબાને તથું-ચાર ઈન્ફેક્શન બ્યાપી હીંવી આપું હું. ઓઝલ ચેતન આવું. કાને પણ વાગ્યે જુદ્ધોઽન અને ઓઝલ જન્મ આપવો અંધ હોયો. રાતે અનિયાર વાગ્યે હું પાણી જે જ સ્થિતિ. હરી ઓઝલ જન્મ આપાયો, પણ યોડા વારમાં ચેતનશીલ જની જતા નાડમાણી વારંવાર નજી એંચતો હતો. જવારે ચાર વાગતી યોડું હું મિઠું અને જાંબી ગયો. ખાં પાર આદ્વાદિપામાં જાને થઈ ગયો. અને રીથી આનંદ બ્યાપી ગયો.

બેરથી હોરપીઠથ જવા નીકળી ત્યારે મને પણ તહેઠું લાગતું કે આદું થશે, પણ સતત રમરણ  
અને ગુરુદેવને પ્રાર્થના કરી કે, આપ તો અત્યારે અમેરિકામાં બિરાજમાન છો, જ્યારે જ્યાપ્ન  
પહેલી વાર અમેરિકા પદ્ધાર્યા ત્યારે કણું હતું કે જે તમારે કંઈ ઉપાય જાવે તો મને યાદ કરનો હું  
સુધેમ સ્વરૂપે આવીને તમને સહાય કરીશ. ગુરુદેવની કૃપાથી અમારા ચાર ભાઈ-બહેન વચ્ચે પ્રથમ  
પુત્રશ્પી કૂલનો જન્મ થયો છે. પણ તે તો ઝૂંટવાઈ જાય જેમ ચોક્કાખ લાગે છે. જેવી આપની છુંબક.  
પણ આપના આપેલા વચ્ચનંથું ! ડૉક્ટર જવારે ટ્રીટમેન્ટ આપતા હતા ત્યારે મા જાયની અને ગુરુદેવ  
આખાના માથા ઉપર જિબા છે અને ગુરુદેવની મુખમુદ્રા હાર્ય સ્વરૂપમાં જાય જિબો. કરી અને  
આખાસન આપતા હતા.

ગુરુદેવ અને મા જાયનીના આશીર્વાદથી જ કરમાયેલું કૂલ કરી પ્રકૃલિત અન્યું. ગુરુદેવ અને  
દેખભાતાની સેવામંડળ દ્વિસે દ્વિસે દદ અને એવી મારી અભ્યર્થના.'

## પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ

**M. N. CHAMPANERIA**

B. E. Civil (HONS), A. M. I.E. (INDIA)



**JANAK ENTERPRISE**

1/29, NAVJIVAN CO OPERATIVE HOUSING SOCIETY,  
LAMINGTON ROAD, BOMBAY-400 008

[ આધ્યાત્મિક ક્ષેત્ર, શુલ્કાંશ, ૧૯૯૫ ]

## **પ. પુ. શ્રી શુક્રદેવના UK(ઇંગ્લિઝ)ના કાર્યાલા**

■ તા. ૧૩ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ : સમય : અપોચે ૪-૩૦ થી ૬-૩૦

**સ્થળ : 9, OLPHIN STREET, OFF BELGRAVE ROAD, LEICESTER  
TEL. 0533-27297**

■ તા. ૧૪ ઓગસ્ટથી ૧૭ ઓગસ્ટ : સમય : અપોચે ૪-૩૦ થી ૭-૦૦

**સ્થળ : 5, EAGLE ROAD, WEMBLEY, MIDDX  
Tel. : 01-902-3029**

■ તા. ૨૨ ઓગસ્ટથી ૨૪ ઓગસ્ટ : સમય : અપોચે ૪-૦૦ થી ૬-૩૦

**સ્થળ : HINDU COMMUNITY CENTRE, 541 A, WARWICK ROAD,  
BIRMINGHAM \* Tel. : 021-5582289**

\* રવિવાર તા. ૨૪ ઓગસ્ટ પુ. શ્રી શુક્રદેવના સાનિધ્યમાં પંચકુંડી શ્રી ગાયત્રી મહાયજ્ઞનું આપેજન ઉપરોક્તા સ્થળે. સમય : જાવારે ૧૦ થી ૫

\* પુ. શ્રી શુક્રદેવના કાર્યક્રમો અંગે વધુ જાણુંની માટે સંપર્ક જાખવો :  
**લેસ્ટર : Tel. 0533-354611**



**પ. શુક્રદેવના આયોરોની અધ્યયના કાલિત**

**આરતી ટ્રેડસ**

**જનરલ મરચન્ડ**

**'ભ અ વ તી'**

**ટેનાની - Rs. ૩૬૧૧૮૫**



## સુમારી

- \* તા. ૬-૮-'૮૬થી તા. ૨૪-૮-'૮૬ સુધી પૂજય શુરુદેવનો ઇંગ્લેન્ડમાં કાર્યથળ હેવાથી અમદાવાદમાં 'નિલોપા' પર મળી શકશે નહીં: તા. ૧-૬-'૮૬ થી રાણેતા સુજખ પુ. શ્રી શુરુદેવ 'નિલોપા' પર મળી શકશે.
  - \* તા. ૨૧-૭-'૮૬ સોમવારે શુરુપૂર્ણાંચે. સવારે ૮ થી ૫ વાગ્યા સુધી પૂજયશ્રીના નિવાસસ્થાને દર્શન, શુરુમંત્રનો લાલ મળી શકશે.
  - \* તા. ૭-૬-'૮૬ રવિવારે પૂજય શુરુદેવની વર્ષાંડ સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી પૂજયશ્રીના નિવાસસ્થાને દર્શનનો લાલ મળી શકશે.
  - \* પૂજયશ્રી શુરુદેવના નિવાસસ્થાનનો ઝોન નંબર બદલાયો છે:
- જૂમો ઝોન ૬૪૬૬૭ કેન્સલ થયો: છે. તેને બદલે નવો ઝોન નંબર ૭૭૬૦૬૭ ચાલુ છે. સાંચે ૬-૩૦ થી ૬-૩૦ સુધી ઉપરોક્ત નવા ઝોન નંબર પર મળી શકશે.

શ્રી ગાયત્રી માતાલુની કૃપા અને પૂજય શુરુદેવના આશિષની અર્થથના

### શ્રી અંબિકા સોએ ફેક્ટરી એન્ડ ટી ડીપે.

૪/૧૩૩, હરીપરા પીરછડી રોડ, અંબિકાસદન, સુરત-૩

— : શ્રી અંબિકા કેમીકલ ઇન્ડસ્ટ્રીઝ : —

૫/૭૬૨, નવી જી, આઈ. ડી. સી., કલારગામ, કુલપાડા રોડ, સુરત-૬

મા ગાયત્રી અને પૂજય શાસ્ત્રીલુના આશિષ અમ સૌ પર વરસતા રહેલા.

### \* શ્રી જ્ય અંબે સોએ એન્ડ ટી રીટેઇલ સોએ \*

૪/૧૩૩, હરીપરા પીરછડી રોડ, અંબિકા સદન, સુરત-૩

### શ્રી અંબિકા ટ્રેક્ષટાઇલ્સ

૫/૭૬૨, નવી જી. આઈ. ડી. સી., કલારગામ, કુલપાડા રોડ, સુરત-૬

[ આધ્યાત્મિક ડેડી, જુલાઈ, '૮૬



પ્રભર ગાયત્રી-ઉપાસક મુ. શ્રી શાસ્ત્રીલ



## પૂજ્ય શુરૂહેવની મુલાકાત

\* આધિ, વ્યાધિ, ઉપાધિથી ત્રસ્ત કોઈપણ વ્યક્તિ, શાતિ, જાતિ, સર્ગ્રહાય કે ધર્મનાં બન્ધનો સિવાય વિનામૂહ્યે પૂજ્ય શુરૂહેવની મુલાકાત લઈ માર્ગદર્શિન મેળવી શકે છે. પ્રત્યક્ષ મુલાકાત શક્ય ન અને તો પણ પૂજ્ય શુરૂહેવના આદેશ અનુસાર ગાયત્રી મહામંત્રની પણ માળાને જીવનના અનિવાર્ય દેનિક કાર્યક્રમમાં વધુ લેને.

મુલાકાત સ્થળ : ‘નીલોધા’ બાંગલો,  
ત્રિમૂર્તિસાસાયટી, ગવર્નમેન્ટ પાંચ બાંગલા પાસે,  
શુલ્કમાર ફ્લેટ્સ પાછળ, શુલ્કાધિનો ટેકરે,  
અમદાવાદ-૧૫.

સમય : બપોરના ૧૨-૦૦ થી ૨-૦૦ (૧૦૧ વ્યક્તિને મુલાકાત)  
શાનિ-રવિ તથા જાદેર રજાના દિવસે બંધ.

- \* પૂજ્ય શુરૂહેવ આપના પત્રો વાંચે છે, પરંતુ લેખિત જવાબ પાડવતા નથી.
- \* શારીરિક-માનસિક રોગો માટે પૂ. શુરૂહેવ જીવનજળ આપે છે.  
સ્વર્ગ ખાતી ભાગલી સાથે લાવવી, જેથી અભિમંત્રિત  
જીવનજળ આપી શકાય.

